



# સુખી થવાની ચાવી

(નિત્ય ચિંતન કાર્યિત)

જે જીવ રાગ-દ્રેષ્ટપ પરિણામેલ હોવાં છતાં પણ  
માત્ર શુદ્ધાત્મામાં (દ્રવ્યાત્મામાં=સ્વભાવમાં) જ  
‘હું પણું’ (એકત્વ) કરે છે અને તેનો જ  
અનુભવ કરે છે, તે જ જીવ સમ્યગ્દ્રષ્ટિ છે  
અર્થાત् તે જ સમ્યગ્દર્શનની રીત છે.

લેખક - CA. જયેશ મોહનલાલ શેઠ  
(બોરીવલી), B.Com., F.C.A.

## -: નમસ્કાર મંત્ર-અર્થ સહિત :-

- નમો અરિહંતાણં - ત્રિકાળવર્તી તીર્થકર પ્રમુખ અરિહંત ભગવંતોને સમય-સમયની વંદણા હોજો!
- નમો સિદ્ધાણં - ત્રિકાળવર્તી સિદ્ધ ભગવંતોને સમય-સમયની વંદણા હોજો!
- નમો આચરિયાણં - ત્રિકાળવર્તી ગણધર પ્રમુખ આચાર્ય ભગવંતોને સમય-સમયની વંદણા હોજો!
- નમો ઉપજગતાચાણં - ત્રિકાળવર્તી ઉપાધ્યાય ભગવંતોને સમય-સમયની વંદણા હોજો!
- નમો લોએ સવ્યસાહૂણં - ત્રિકાળવર્તી સાધુ ભગવંતોને સમય-સમયની વંદણા હોજો!
- એસો પંચ નમ્મોકારો - આ પાંચ નમસ્કાર સૂત્ર
- સવ્ય પાવ પણાસણો - સર્વ પાપોનો નાશ કરનારા છે.
- મંગલાણં ચ સવ્યેસિં - સર્વ મંગલોમાં
- પઠમં હવઈ મંગલં - ઉત્કૃષ્ટ મંગલ છે

## -: પંચ પરમેષ્ઠિ વંદન શલોક :-

અહન્તો ભગવન્ત ઈન્દ્રમહિતા:, સિદ્ધાશ્ચ સિદ્ધિશ્રિતા:  
આચાર્યા, જિનશાસનોત્ત્રતિકરા:, પૂજ્યા ઉપાધ્યાયકા ।  
શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકા:  
પંચૈતે પરમેષ્ઠિન પ્રતિદિનઃ, કુર્વન્તુ નો મંગલમ् ॥

# સુખી થવાની ચાવી

(નિત્ય ચિંતન સહિત)

- લેખક -

CA. જયેશ મોહનલાલ શેઠ (બોરીવલી), B.Com., F.C.A.

- અર્પણ -

માતા - પૂ. કાંતાબેન તથા

પિતા - પૂ. સ્વ. મોહનલાલ નાનચંદ શેઠને.

જે જીવ રાગ-દ્રેષ્ટુપ પરિણામેલ હોવાં છતાં પણ માત્ર શુદ્ધાત્મામાં (દ્રવ્યાત્મામાં=સ્વભાવમાં) જ ‘હું પણું’ (એકત્વ) કરે છે અને તેનો જ અનુભવ કરે છે, તે જ જીવ સમ્યગુદ્રષ્ટિ છે અર્થાત् તે જ સમ્યગુદર્શનની રીત છે.

પ્રકાશક : શૈલેશ પુનમચંદ શાહ

# અનુમોદક - જયકળા નલિન ગાંધી પરિવાર

## - અનુકમણિકા -

| ક્રમ | વિષય                | પૃષ્ઠ |
|------|---------------------|-------|
| ★    | પ્રસ્તાવના          | iii   |
| ★    | લેખકના હૃદયોદગારો   | vii   |
| ૧    | સુખી થવાની ચાવી     | ૧     |
| ૨    | સપારે ઉઠીને         | ૧૯    |
| ૩    | સમાધિ મરણ ચિંતન     | ૩૦    |
| ૪    | કંદમૂળ વિશે         | ૩૪    |
| ૫    | રાત્રિસોજન વિશે     | ૩૬    |
| ૬    | બાર ભાવના           | ૩૮    |
| ૭    | નિત્ય ચિંતન કહિાકાઓ | ૪૨    |
| ૮    | ચુનિવર્સિટ લો       | ૪૭    |

સમ્યગ્દર્શન વિશે અધિક ગહુન અભ્યાસ માટે હિંગંબર શાસ્ત્ર આધારિત દ્રવ્યાનુયોગ અને વસ્તુ વ્યવસ્થા સહિત લેખકની અન્ય હૃતિ નિઃશુલ્ક મેળવો - 'સમ્યગ્દર્શનની રીત'

આ પુસ્તક અને અન્ય સાહિત્યની **pdf Ebook available on website [www.jayeshsheth.com](http://www.jayeshsheth.com)** ડાઉનલોડ કરી શકાશો.

### © CA. જ્યેશ મોહનલાલ શેઠ

મૂલ્ય : અમૃત્ય

ગુજરાતી - સોળમી આવૃત્તિ - વિ.સં. ૨૦૭૬ (જાન્યુ.૨૦૨૦) પ્રતિ : ૪,૦૦૦

ગુજરાતી : ૨,૮૩,૦૦૦ • હિન્દી : ૪,૭૭,૦૦૦ • અંગ્રેજી : ૨૫,૦૦૦ કુલ : ૭,૮૫,૦૦૦

નાંદ્ય - આ પુસ્તક કોઈને છપાવવું હોય તો, અમારો સંપર્ક કરવા વિનંતિ છે.

વિશેષ - જો આપને આ પુસ્તક વાચ્યા બાદ જરૂરત ન હોય તો આશાતનાથી બચવા નીચેના સ્થળોએ પરત કરવા વિનંતિ છે.

### - સંપર્ક અને પ્રાપ્તિ સ્થાન -

શૈલેશ પુનમચંદ શાહ - ૪૦૨, પારિજાત, સ્વામી સમર્થ માર્ગ,

(હનુમાન કોસ રોડ નં ૨), વિલેપાર્ક (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૫૭.

ફોન નં ૨૬૧૩ ૩૦૪૮ મોબાઇલ નં ૮૮૮૮૨૪૩૬૭૫૮/૮૩૨૪૩૩૭૩૨૬

Email : spshah1959@gmail.com

જયકળા નલિન ગાંધી - સી/૫૦૨, એડવેન્ટ નીલ રેસિડન્સી, પૂર્વપ્રિંકા હાઇસ્કુલની બાજુમાં, ભરૂચા રોડ, ભાટલાદેવી મંદિરની પાછળ, દહિસર (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૮.

ફોન નં ૨૮૮૫ ૨૫૩૦ મોબાઇલ નં. ૮૮૩૩૬ ૭૭૪૪૭ / ૮૮૨૧૬ ૫૨૫૩૦

Email : nalingandhi123@gmail.com

ટાઇપ સેરીઝ : સમીર પારેખ - કિએટીએ પેજ સેર્ટર્સ ફોન : ૯૮૯૬૦ ૦૮૫૦૭

મુદ્રાગ : નિલેશ પારેખ - પારસ પ્રિન્ટસ, ગોરેગામ, મુંબઈ ફોન : ૯૮૬૬૭૧ ૭૬૪૩૨

## પ્રસ્તાવના

અનંત અનંત કાળથી સંસાર સાગરમાં રહડતા જીવને  
ભગવાને કહેલી દુર્લભતાઓ (મનુષ્યભવ, આર્થિક્ષેત્ર, ઉત્તમ  
કુળ, દીર્ઘ આચુ, પૂર્ણ ઈજ્ઞિયો, નીરોગી શરીર, સાચા ગુરુ,  
સાચા શાસ્ત્ર, સાચી શ્રદ્ધા અર્થાત् સમ્યગુર્દર્શન અને  
મુનિપણું)માંથી શરૂઆતની આઠ દુર્લભતા આપણાને અનંતીવાર  
મળી છે છતાં આપણા જીવની અર્થાત્ આપણી દિશા બદલાણી  
નહિ. ઘાંચીના બળદની જેમ ચાર ગતિમાં પરિભ્રમણ કરતા રહ્યા  
પરંતુ પંચમ ગતિ અર્થાત્ મોક્ષમાર્ગ માટે પ્રગતિ ન થઈ તેનું  
કારણ જ્ઞાનીઓ એવું બતાવે છે કે આઠ દુર્લભતા મળ્યાં પછી  
જો જીવ નવમી દુર્લભતા ન પામે એટલે કે આત્મ અનુભવ  
(સ્પર્શના) ન કરે અર્થાત્ સમ્યગુર્દર્શન ન પામે તો સંસારનો ફેરો  
ટળતો નથી, અર્થાત્ મોક્ષમાર્ગ મળતો નથી.

તો અત્રે પ્રસ્તુત છે ‘સુખી થવાની ચાવી’ આત્મા પ્રાપ્ત  
કરવાનો એક અતિ વેદક, સચોટ અને સીધો ઈલાજ. લેખક  
શ્રી જ્યેશભાઈ શેઠ, વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે તેમણે  
તેમના વર્ષોનાં વાંચન, ચિંતન, મનન, અભ્યાસ, અનુભવને  
આચરણમાં મૂક્યા પશ્ચાત આ માનવસમાજનાં કલ્યાણાર્થે,

કરણાથી અને શાસ્ત્રોના આધારથી સનાતન સત્યો દ્વારા આત્મપ્રાપ્તિનો સરળ માર્ગ દર્શાવેલ છે. કેટલાંચ આગમો વાંચતા, પુસ્તકો વાંચતા, વ્યાખ્યાનો સાંભળતા મનમાં કેટલાંચ પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે, કોઈવાર અનેક મતોને કારણે મૂળ સિદ્ધાંત ભૂલાય અને વિષયાંતર તથા વિવાદોમાં મુખ્ય વાત અને સમજ વિસારે પડી જાય છે. લેખકનો આ એક ઉત્તમ પ્રચાસ છે કે આ વિશ્વનો દરેક જીવ, કેવી રીતે સુખી થાય તેના શાશ્વત સિદ્ધાંતોને તેમણે ટૂંકી, સરળ અને સુગમ ભાષામાં આપણાને પિરસ્યા છે.

એવી એક અંગ્રેજુ કહેવત છે કે સફળ વ્યક્તિ કાંઈ નવું નથી કરતી, જે પાચાના નિયમો છે અને સિદ્ધાંતો છે તેને જ નિયમિત રીતે પોતાના જીવનમાં ઉતારી તે સફળ બની જાય છે; તે ન્યાયે, આપણે આ સુખી થવાની ચાવીની સનાતન વાતો જીવનમાં વણી લઈએ અને ભવોભવના આંટા ટાળી દઈએ. ભગવાન કૃપાએ અને લેખકની અસીમ કૃપા, કરણા અને આપણા અહોભાગ્યથી આપણાને તે ભવોભવના ચકદ્યુહને બેદવાની સાઈ-સરળ ચાવી, અદના (સામાન્ય) માણસ (common man) ને પણ સમજાય તેવી ભાષા અને શૈલીમાં પ્રાપ્ત થઈ છે. તેમનો આ પ્રચતન ત્યારે જ સફળ થયો ગણાશે

જ્યારે આ ચાવીથી દરેક વાંચક, પોતાના આત્માને ભવોભવના બંધનરૂપ તાળાથી મુક્ત કરાવે (ઇડાવે) અર્થાત્ નિત્ય વાંચન, મનન, ચિંતન અને અમલ કરવાથી શું અશક્ય છે? કાંઈ જ નહિ. જો એક દેડકો કે એક સિંહ..... સમ્યગુર્દર્શન પામીને મોક્ષગામી બની શકે તો વિવેકસહિત પાંચ ઇન્જ્રીયોવાળાં આપણે અર્થાત્ મનુષ્ય એક સચોટ નિર્ણય લઈ સમ્યગુર્દર્શન પામીને મોક્ષગામી ન બની શકીએ???? અર્થાત્ જરૂર બની શકીએ... તો વાંચો, વિચારો, ચિંતન કરો અને અપનાવો પ્રસ્તુત ‘સુખી થવાની ચાવી’ને કે જેથી મોક્ષમાર્ગ અને અંતે મોક્ષ મેળવી અનંત અવ્યાબાધ સુખ મેળવો એવી આશા સહિત.

લી.

જીતેન્દ્ર શાંતિલાલ શાહુ

CA. મુકેશ પુનમચંદ શાહુ, F.C.A.

શૈલોશ પુનમચંદ શાહુ

જ્યકણા નલીન ગાંધી

નમીતા રસેશ શાહુ



## લેખકના હૃદયોદ્ગારો

આ પુસ્તક આધ્યાત્મિક કાન્તિ સર્જવા લખેલ છે કારણ કે આ કાળમાં જૈન સમાજ બે વિભાગમાં વહેંચાઈ ગયેલ છે; જેમાંથી એક વિભાગ એવો છે કે જે માત્ર વ્યવહાર નયને જ માન્ય કરે છે અને માત્ર તેને જ પ્રાધાન્ય આપે છે અને માત્ર તેનાથી જ મોક્ષ માને છે, જ્યારે બીજો વિભાગ એવો છે કે જે માત્ર નિશ્ચય નયને જ માન્ય કરે છે અને માત્ર તેને જ પ્રાધાન્ય આપે છે અને માત્ર તેનાથી જ મોક્ષ માને છે. પરંતુ ખરેખરો મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારની યોગ્ય સંદ્ઘિમાં જ છે કે જે વાત માત્ર કોઈક વિરલા જ જાણો છે કે જે વાત આ પુસ્તકમાં સમજાવવાનો પ્રયાસ કરેલ છે.

અત્યારે જૈન સમાજમાં પ્રવર્તતી તત્ત્વ વિશેની આવી ગેરસમજોને દૂર કરવા અમે અમારા આત્માની અનુભૂતિપૂર્વકના વિચારો શાસ્ત્રના આધાર સહિત આ પુસ્તકમાં પ્રસ્તુત કરીએ છીએ, જેનો વિચાર-ચિંતન-મનન આપ ખુલ્લા મનથી અને ‘સારું તે જ મારું’ અને ‘સાચું તે જ મારું’ એવો અભિગમ અપનાવીને કરશો તો અવશ્ય આપ પણ તત્ત્વની પ્રતીતિ જરૂર કરી શકશો એવો અમને વિશ્વાસ છે.

મને નાની ઉંમરથી જ સત્યની શોધ હતી અને તેને માટે સર્વ દર્શનનો અભ્યાસ કર્યો અને અંતે જૈન દર્શનના અભ્યાસ પણ્યાત् 1999માં 38 વર્ષની ઉંમરે મને સત્યની પ્રાપ્તિ થઇ અર્થાત् તેનો અનુભવ/સાક્ષાત્કાર થયો. તદ્પણ્યાત् જૈન શાસ્ત્રોનો પુનઃ પુનઃ સ્વાધ્યાય કરતાં અનેક વખત સત્યનો

અર્થાત् શુદ્ધાત્માનો અનુભવ થયો કે જેની રીત આ પુસ્તકમાં સર્વેજનોના લાભાર્થે આપવાનો પ્રયત્ન કરેલ છે.

અમે કોઈપણ મત-પંથમાં નથી અમે માત્ર આત્મામાં છીએ અર્થાત् માત્ર આત્મધર્મમાં જ છીએ તેથી કરીને અત્રે અમે કોઈપણ મત-પંથનું મંડન અથવા ખંડન ન કરતાં માત્ર આત્માર્થે જે ઉપયોગી છે તે જ આપવાની કોશિશ કરેલ છે માટે સર્વેજનોએ તેને, તે જ અપેક્ષાએ સમજવું એવી અમારી વિનંતી છે.

આ પુસ્તક વિશે સામાન્ય અને વિદ્ધતજનો તરફથી ઉત્કૃષ્ટ અભિપ્રાય પ્રાપ્ત થયેલ છે અને તેથી જ આ પુસ્તકની દસમી આવૃત્તિ છાપવામાં આવી રહેલ છે, તેથી તે સર્વેજનોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમને આ પુસ્તક તૈયાર કરવામાં, છપાવવામાં તથા વિતરણ કરવામાં અનેક લોકોએ અલગ-અલગ રીતે સહકાર આપેલ છે, તે સર્વેના અમે ઋણી છીએ; તેથી તે સર્વેજનોનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

અમારા આત્માની અનુભૂતિપૂર્વકના વિચારોને આપ પરીક્ષા કરીને અને અત્રે આપેલ શાસ્ત્રોના આધારથી સ્વીકાર કરીને સમ્યગુર્દ્ધન પ્રગટ કરો કે જેથી આપ પણ ધર્મરૂપ પરિણામો અને મોક્ષમાર્ગ ઉપર અગ્રેસર બની અંતે સિદ્ધત્વને પામો એ જ અભ્યર્થીના સહ.

પ્રસ્તુત પુસ્તકમાં જાણ્યે-અજાણ્યે મારાથી કાંઈપણ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિદ્યે-ત્રિવિદ્યે મારા મિશ્શામિ દુક્કડું!

CA. જ્યેશ મોહનલાલ શેઠ

મુંબઈ, 29-06-2014.

VIII ♦ સુખી થવાની ચાવી



# સુખી થવાની ચાવી



સર્વ પ્રથમ પંચ પરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરીને અમે સુખી થવાની ચાવી વિષે લખવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે સર્વે જીવો સુખના જ અર્થી હોય છે, દુઃખથી તો સર્વે જીવો દૂર જ રહેવાનો પ્રયત્ન કરે છે. તે સુખ બે પ્રકારના છે. એક શારીરિક-ઇન્ડ્રિયજન્ય સુખ, કે જે ક્ષાળિક (temporary) છે અને બીજું આત્મિક સુખ, કે જે શાશ્વતું (permanent) છે.

પ્રથમ અમે શારીરિક-ઇન્ડ્રિયજન્ય સુખ વિષે જણાવીશું કારણ કે તેનાથી સર્વે જીવો ચિર-પરિચિત છે. તેવાં સંસારી જીવોને સુખ એટલે ઉત્તમ સ્વાસ્થ્ય (health), અફળક પૈસો (wealth) તથા અનુકૂળ પતની, પુત્ર વગેરે પરિવાર (good family). આ સર્વે સુખનો ઋત (source) શું છે? તો આપ કહેશો કે સદનસીબ (good luck). તો પ્રશ્ન થશે કે તે સદનસીબી મળે કઈ રીતે? બને કઈ રીતે? તો તેનો ઉત્તર છે પુણ્યથી. કારણ કે જે આપણું પૂર્વ પુણ્ય છે તેને જ સદનસીબ કહેવાય છે. જ્યારે પૂર્વ પાપોને બદનસીબ (bad luck) કહેવાય છે. તેથી કરીને જેઓએ પોતાનું નસીબ સારું બનાવવું છે

તેઓને પુણ્યની અત્યંત આવશ્યકતા છે અને સાથે પાપથી બચવાની પણ અત્યંત આવશ્યકતા છે કારણ કે પાપ તથા પુણ્ય સામ-સામે સરભર થતાં નથી, બંને અલગ-અલગ ભોગવવાં પડે છે. પાપનું ફળ દુઃખરૂપ હોય છે, કે જે કોઈ પણ જીવ ઈરછતાં નથી. જો દુઃખરૂપ ફળ જીવ ઈરછતો નથી, તો તેના જનકરૂપ પાપ કઈ રીતે આચરાય? અર્થાત્ ન જ આચરાય, કદી જ ન આચરાય.

તેથી સદ્ગુરીની બનાવવાં તથા બદ્ધનસીબીથી બચવા-બદ્ધનસીબી ઘટાડવાં રોજિંદા જીવનમાં જે કોઈ મોટાં પાપો થાય છે તે બંધ કરવાં આવશ્યક છે, જેવાં કે- કંદમૂળ-ભક્તાણ, રાત્રિભોજન, સપ્ત-મહાવ્યસન (જુગાર, દાર્ઢ, માંસ, વેશ્યાગમન, ચોરી, શિકાર અને પરાણીગમન અથવા પરપુરુષગમન) તથા અભક્તા-ભક્તાણ- જેમ કે બોળ અથાણાં, મધ્ય, માખણ વગેરે તથા અન્યાય-અનીતિથી અર્થોપાર્જન ન કરવું. આવાં મોટાં પાપો બંધ કરતાં જ નવાં દુઃખનું આરક્ષણ બંધ થઈ જશે અને જૂનાં પાપોનો પશ્વાતાપ કરતાં, કોઇ, માન, માચા, લોલ ઓછાં કરતાં (પરંતુ ભાવના તેઓને પૂર્ણ છોડવાની રાખવી અર્થાત્ ભાવના વીતરાગી બનવાની રાખવાની) તથા બાર/સોળ ભાવનાનું ચિંતન કરતાં નવાં પુણ્યનો બંધ થાય છે તથા જૂનાં પાપોનો બંધ શીથિલ થાય છે અર્થાત્ જૂનાં પાપો

હળવાં બને છે. આ જ સદ્ગનસીબ બનાવવાનો તથા બદ્ધનસીબીથી બચવાનો માર્ગ છે.

અતે કોઈને પ્રશ્ન થાય કે અમને તો અમુક દેવ-દેવીની ફૂપા તથા તેમના દર્શન-ભક્તિ કરવાથી જ સુખ મળતું દેખાય છે. તો તેઓને અમારો ઉત્તર એ છે કે- તે સુખ આપના પૂર્વ પુણ્યનું જ ફળ છે. જો આપના પાપનો ઉદ્દય હોય તો કોઈ જ દેવ-દેવી તેને પુણ્યમાં ફેરવવા માટે શક્તિમાન નથી. પુણ્યનું ફળ માંગવું તે નિદાનશાસ્ત્રાદ્યાપ હોવાથી, ઘણાં બધા પુણ્યનું અદ્યાત્મ ફળ મળે છે અને તે સુખ ભોગવતી વખતે નિયમથી ઘણાં જ પાપો બંધાય છે, કે જે ભવિષ્યના દુઃખોના જનક (કારણ) બને છે. તેથી માંગો અથવા ન માંગો, આપને આપના પૂર્વ પુણ્ય-પાપનું ફળ અવશ્ય જ મળે છે, આ જ શાશ્વત નિયમ હોવાં છતાં, માંગીને પાપને આવકાર-આમંત્રણ (booking or invitation) શું કામ આપવું? અર્થાત્ ન જ માંગવું, કદી ન માંગવું.

તેથી એકવાત તો નિશ્ચિત જ છે કે પોતાને જે કાંઈપણ દુઃખ આવે છે તેમાં વાંક પોતાના પૂર્વ પાપોનો જ હોય છે, અન્ય કોઈનો'ય નહિં. જે અન્ય કોઈ દુઃખ આપતાં જણાય છે, તે તો માત્ર નિમિત્તાદ્યાપ જ છે. તેમાં તેમનો કાંઈ જ દોષ નથી, તે તો આપને, આપના પાપથી છોડાવવાવાળાં જ છે. છતાં આવી

સમજણ ન હોવાથી, આપને નિમિત પ્રત્યે જરાપણ રોખ આવે, તો ફરીથી આપને પાપનું બંધન થાય છે કે જે ભવિષ્યના દુઃખોનું જનક (કારણ) બને છે. આજ રીતે અનાદિથી આપણે દુઃખો ભોગવતાં, નવાં દુઃખોનું સર્જન કરતાં રહ્યાં છીએ અને અત્યારે પણ કરી રહ્યાં છીએ. માટે આવાં અનંત દુઃખોથી છુટવાનો માત્ર એક જ માર્ગ છે કે દુઃખના નિમિતને હું ઉપકારી માનું કારણ કે તે મને પાપથી છોડાવવામાં નિમિત થયેલ છે. તે નિમિતનો જરાપણ વાંક-ગુનો ન ચિંતવું, પરંતુ પોતાના પૂર્વ પાપો જ, અર્થાત્ પોતાના જ પૂર્વના દુષ્કૃત્યો જ વર્તમાન દુઃખનું કારણ છે. તેથી દુઃખ વખતે એમ ચિંતવવું કે- ઓહો! મેં આવું દુષ્કૃત્ય કરેલું! દિક્કાર છે મને! દિક્કાર છે!! મિરછામિ દુક્કડં! મિરછામિ દુક્કડં!! (આ છે પ્રતિક્રમણ) અને હવે નક્કી કરં છું કે આવા કોઈ જ દુષ્કૃત્યનું આચરણ હવે પણી કદી નહીં જ કરં! નહીં જ કરં!! (આ છે પ્રત્યાખ્યાન) અર્થાત્ પોતાના દુઃખના કારણ તરીકે અન્યોને દોષિત જોવાનું છોડી, પોતાના જ પૂર્વે કરેલા ભાવો અર્થાત્ પૂર્વના પોતાના જ પાપ કર્મોનો જ દોષ નિહાળી, અન્યોને તે પાપોથી છોડાવવાવાળાં સમજુને, ધન્યવાદ આપો (Thank you! Welcome!) અને નવાં પાપથી બચો.

જો આપ સુખના અર્થી છો, તો આપ દરેકને સુખ આપો!

અર્થાત् આપ જે આપશો, તે જ આપને મળશો; આવો છે કર્મનો સિદ્ધાંત. આપના વર્તમાન દુઃખનું કારણ આપે પૂર્વે કરેલ પાપ કર્મો જ છે, તેથી જો આપ દુઃખ ન ઈચ્છાતા હો તો વર્તમાનમાં આપ બીજાને દુઃખ આપવાનું બંધ કરો અને ભૂતકાળમાં આપે જે બીજાને દુઃખ આપેલ હોય તેનો પશ્ચાતાપ કરો, તેનું ચિંતન કરી મનમાં પસ્તાવો કરો-માફી માંગો.

અત્રે કોઈને પ્રશ્ન થાય કે જગતમાં તો પાપી પણ પૂજાતાં જાણાય છે, અત્યંત સુખી જાણાય છે. તો તેનો ઉત્તર એવો છે કે તે તેઓના પૂર્વ પુણ્યનો પ્રતાપ છે, જ્યારે પાપીને વર્તમાનમાં ઘણાં ગાઢાં પાપોનો બંધ પડતો જ હોય છે કે જે તેઓના અનંત ભવિષ્યમાં અનંત દુઃખોનું કારણ બનવા શક્તિમાન હોય છે. તેથી કોઈનાં પણ વર્તમાન ઉદય ઉપર બ્રહ્મિન કરવી કારણ કે તે તો તેના ભૂતકાળના કર્મો ઉપર જ આધારિત હોય છે, પરંતુ માત્ર વર્તમાન પુરુષાર્થ ઉપર બ્રહ્મિન કરવાં જેવી છે કારણ કે તે જ તેનું ભવિષ્ય છે. અર્થાત् કોઈ પોતાનો વર્તમાન ઉદય બદલી શકવા પ્રાય: શક્તિમાન નથી, પરંતુ પોતાનું ભવિષ્ય ઘડવા શક્તિમાન છે અને તેથી જ જીવ પુરુષાર્થ કરી સિદ્ધત્વ પણ પામી શકે છે માટે જ પોતાના ઉદય ઉપર બ્રહ્મિન કરતાં અર્થાત् તેમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ન કરતાં માત્ર ને માત્ર આત્માર્થે જ પુરુષાર્થ કરવા યોગ્ય છે.

અતે જણાવેલ શારીરિક-ઇન્ડ્રીયર્જન્ય સુખ તે ખરેખરું સુખ નથી, પરંતુ તે માત્ર સુખાભાસરૂપ જ છે અર્થાત્ તે સુખ દુઃખપૂર્વક જ હોય છે અર્થાત્ તે સુખ ઇન્ડ્રીયોની આકુળતારૂપ દુઃખને/વેગને શાંત કરવા જ સેવવામાં આવે છે છતાં તે અન્નિમાં ઈંધણરૂપ ભાગ બજવે છે અર્થાત્ તે ફરી-ફરી તેની ઈચ્છારૂપ દુઃખ જગાડવાનું જ કામ કરે છે અને તે ભોગ ભોગવતાં જે નવા પાપ બંધાય છે તે નવા દુઃખોનું કારણ બને છે અર્થાત્ તેવાં સુખ દુઃખપૂર્વક અને દુઃખરૂપ ફળ સહિત જ હોય છે. બીજું, તે ક્ષણિક છે કારણ કે તે સુખ અમુક કાળ પછી નિયમથી જવાવાનું છે અર્થાત્ જીવને આવું સુખ માત્ર ત્રસ પર્યાયમાં જ મળવા ચોગય છે કે જે બહુ ઓછા કાળ માટે હોય છે, પછી તે જીવ નિયમથી એકેંદ્રિયમાં જાય છે કે જ્યાં અનંતકાળ સુધી અનંતદુઃખો ભોગવવા પડે છે, અને એકેંદ્રિયમાંથી બહાર નીકળવું પણ ભગવાને ચિંતામણિારતનની પ્રાપ્તિ તુલ્ય દુર્લભ જણાવેલ છે. તેથી જ ભગવાને આ મનુષ્યજન્મ, પૂર્ણ ઇન્ડ્રીયોની પ્રાપ્તિ, આયદિશ, ઉર્ચયકુળ, ધર્મની પ્રાપ્તિ, ધર્મની દેશના, ધર્મની શ્રદ્ધા, ધર્મરૂપ પરિણામન વગેરેને એક એકથી અધિક અધિક દુર્લભ જણાવેલ છે. માટે આ અમૂલ્ય-દુર્લભ મનુષ્યજન્મ માત્ર શારીરિક-ઇન્ડ્રીયર્જન્ય સુખ અને તેની પ્રાપ્તિ પાછળ ખર્ચવા જેવો નથી, પરંતુ તેની એક પણ પળને વ્યર્થ ન ગુમાવતાં,

માત્રને માત્ર, ત્વરાએ શાશ્વત સુખ એવા આત્મિક સુખની પ્રાપ્તિ અર્થે જ લગાવવા યોગ્ય છે.

હવે અમે શાશ્વત સુખ એવા આત્મિક સુખની પ્રાપ્તિનો માર્ગ જણાવીએ છીએ. સર્વપ્રથમ માત્ર આત્મલક્ષે, ઉપર જણાવેલ સુખની ચાવીરૂપ શુભભાવનું સમ્યગ્દર્શન માટેની આત્માની યોગ્યતા અર્થે સેવન કરવું આવશ્યક છે કારણ કે સમ્યગ્દર્શન એ મોક્ષમાર્ગનો દરવાજો છે, અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ જ થતો નથી અને મોક્ષમાર્ગમાં પ્રવેશ વગર આવ્યાબાધ સુખનો માર્ગ સાદ્ય થતો જ નથી. અર્થાત્ મોક્ષમાર્ગમાં પ્રવેશ અને પછીના પુરુષાર્થી જ સિદ્ધત્વ રૂપે માર્ગ ફળ મળે છે અન્યથા નહિ. સમ્યગ્દર્શન વગર ભવકટી (ભવનો અંત) પણ થતી (થતો) નથી. સમ્યગ્દર્શન થયા પછી જીવ અર્ધપુરુષ પરાવર્તન કાળથી વધારે સંસારમાં રહેતો નથી, તે અર્ધપુરુષ પરાવર્તન કાળમાં જરૂર સિદ્ધત્વને પામે જ છે કે જે સત્-ચિત્-આનંદસ્વરૂપ શાશ્વત છે. આથી સમજાય છે કે આ માનવભવમાં જો કાંઈપણ કરવા જેવું હોય તો તે છે એક માત્ર નિશ્ચય સમ્યગ્દર્શન, તે જ પ્રથમમાં પ્રથમ પ્રાપ્ત કરવા જેવું છે. જેથી કરીને પોતાને મોક્ષમાર્ગમાં પ્રવેશ મળે અને પુરુષાર્થ ફોરવતા આગળ સિદ્ધપદની પ્રાપ્તિ થાય. અતે એ સમજવું આવશ્યક છે કે જે સાચા દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે કહેવાતી

શ્રદ્ધારૂપ અથવા તો નવતરણની કહેવાતી શ્રદ્ધારૂપ સમ્યગદર્શન છે તે તો માત્ર વ્યવહારિક (ઉપચારરૂપ) સમ્યગદર્શન પણ હોઈ શકે છે કે જે મોક્ષમાર્ગના પ્રવેશ માટે કાર્યકારી ગણાતું નથી. પરંતુ સ્વાનુભૂતિ (સ્વાત્માનુભૂતિ) સહિતનું સમ્યગદર્શન અર્થાત્ બેદજ્ઞાન સહિતનું સમ્યગદર્શન જ નિશ્ચય સમ્યગદર્શન કહેવાય છે અને તેના વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ પણ શક્ય નથી, તેથી કરીને અતે જળાવેલ સમ્યગદર્શન તે નિશ્ચય સમ્યગદર્શન સમજવું.

પ્રથમ આપણે સમ્યગદર્શનનું સ્વરૂપ સમજાશું. સમ્યગદર્શન એટલે દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું, અન્યથા નહિ અને જ્યાં સુધી કોઈપણ આત્મા પોતાનું યથાર્થ સ્વરૂપ સમજતો નથી અર્થાત્ સ્વની અનુભૂતિ કરતો નથી ત્યાં સુધી દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ પણ જાણતો નથી પરંતુ તે માત્ર દેવ-ગુરુ-ધર્મના બાબ્ય સ્વરૂપની/વેશની જ શ્રદ્ધા કરે છે અને તે તેને જ સમ્યગદર્શન સમજે છે પરંતુ તેવી દેવ-ગુરુ-ધર્મની બાબ્ય સ્વરૂપની/વેશની જ શ્રદ્ધા યથાર્થ શ્રદ્ધા નથી અને તેથી તે નિશ્ચય સમ્યગદર્શનનું લક્ષણ નથી કારણા કે જે એકને (આત્માને) જાણો છે તે સર્વેને (જીવ-અજીવ વગેરે નવ તરફો અને દેવ-ગુરુ-ધર્મના યથાર્થ સ્વરૂપને) જાણો છે અન્યથા નહિ કારણ કે તે વ્યવહારનયનું કથન છે. અર્થાત્ એક આત્માને જાણતા જ તે જીવ

સાચા દેવ તત્ત્વનો અંશે અનુભવ કરે છે અને તેથી તે સાચા દેવને અંતરથી ઓળખે છે અને તેમ સાચા દેવને જાણતા જ અર્થાત્ (સ્વાનુભૂતિ સહિતની) શ્રદ્ધા થતાં જ તે જીવ તેવા દેવ બનવાના માર્ગ ચાલતા સાચા ગુરુને પણ અંતરથી ઓળખે છે અને સાથે-સાથે તે જીવ તેવા દેવ બનવાનો માર્ગ બતાવતા સાચા શાસ્ત્રને પણ ઓળખે છે. માટે પ્રથમ તો શરીરને, આત્મા ન સમજવો અને આત્માને, શરીર ન સમજવું. અર્થાત્ શરીરમાં આત્મબુદ્ધિ હોવી તે ભિથ્યાત્વ છે. શરીર તે પુદ્ગાલ દ્રવ્યનું બનેલ છે અને આત્મા તે અલગ જ દ્રવ્ય હોવાથી પુદ્ગાલને આત્મા સમજવો અથવા આત્માને પુદ્ગાલ સમજવું તે વિપરીત સમજણ છે. બીજી રીતે પુદ્ગાલથી ભેદજાન અને સ્વના અનુભવરૂપ જ ખરેખરં સમ્યગદર્શન હોય છે અને તે કર્મથી જોવામાં આવે તો કર્મોની સાત પ્રકૃતિનો ઉપશામ, ક્ષયોપશામ અથવા ક્ષયને સમ્યગદર્શન કહેવાય છે. પરંતુ છદ્મસ્થને કર્મોનું જ્ઞાન થતું નથી, માટે આપણે તો પ્રથમ કસોટીથી અર્થાત્ પુદ્ગાલથી ભેદજાન અને સ્વાનુભવરૂપ (આત્માનુભૂતિરૂપ) જ સમ્યગદર્શન સમજવું. તેથી કરીને પ્રશ્ન થાય કે સમ્યગદર્શન કરવા માટે, શું કરવું જરૂરી છે ?

**ઉત્તર -** ભગવાને કહ્યું છે કે ‘સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે’ એ વાત સમજવી જરૂરી છે. સંસારી જીવો શરીરસ્થ

છે અને સિદ્ધના જીવો તો મુક્ત છે, તો સંસારીને સિદ્ધ જેવા કહ્યાં, તે કઈ અપેક્ષાએ? ઉત્તર - તે શુદ્ધ દ્રવ્યાયાર્થિકનયની અપેક્ષાએ. જેમકે સંસારી જીવો શરીરસ્થ હોવા છતાં, તેમનો આત્મા એક જીવત્વ રૂપ પારિણામિક ભાવરૂપ હોય છે; તે જીવત્વરૂપભાવ ઈદ્મસ્થને (અશુદ્ધદ્રવ્યાયાર્થિકનયે કરી) અશુદ્ધ હોય છે અને તેના કષાયાત્મા વગેરે આઠ પ્રકાર પણ કહ્યાં છે. તે અશુદ્ધ જીવત્વભાવ અર્થાતું અશુદ્ધરૂપે પારિણામેલ આત્મામાંથી અશુદ્ધિને (વિભાવભાવને) ગૌણ કરતાં જ, જે જીવત્વરૂપ ભાવ શેષ રહે છે તે જ પરમ પારિણામિકભાવ, શુદ્ધભાવ, શુદ્ધાત્મા, કારણપરમાત્મા, સિદ્ધસદશભાવ, સ્વભાવભાવ વગેરે અનેક નામોથી ઓળખાય છે અને તે ભાવની અપેક્ષાએ જ ‘સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે’ એમ કહેવાય છે. આ જ વાત શ્રી ભગવતીજી (ભગવદ્/વિવાહપત્રતિ) સૂત્રમાં ૧૨માં શતકમાં ઉદ્દેસો ૧૦માં કહેલ છે, “હે ભગવાન! આત્મા કેટલા પ્રકારના કહ્યાં છે? હે ગૌતમ! આઠ પ્રકારના. તે દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા છે. હે ભગવાન! જેને દ્રવ્યાત્મા હોય તેને શું કષાયાત્મા હોય અને કષાયાત્મા હોય તેને દ્રવ્યાત્મા હોય? હે ગૌતમ! જેને દ્રવ્યાત્મા હોય તેને કષાયાત્મા કદાચિત હોય કદાચિત ન હોય

પણ જેને કષાયાત્મા હોય, તેને તો અવશ્ય દ્રવ્યાત્મા હોય. હે ભગવાન! જેને દ્રવ્યાત્મા હોય તેને યોગાત્મા હોય? એ પ્રમાણે જેમ દ્રવ્યાત્મા અને કષાયાત્માનો સંબંધ કહ્યો તેમ દ્રવ્યાત્મા અને યોગાત્માનો સંબંધ કહેવો. (અર્થાત् જેને દ્રવ્યાત્મા હોય તેને યોગાત્મા કદચિત હોય કદચિત ન હોય પણ જેને યોગાત્મા હોય, તેને તો અવશ્ય દ્રવ્યાત્મા હોય).” આમ શ્રી ભગવતીજુ (ભગવઈ/વિવાહપત્રતિ) સૂત્રમાં ૧૨માં શતકમાં ઉદ્દેસો ૧૦માં જણાવ્યા અનુસાર દ્રવ્યાત્મા દ્વેક જીવમાં હોય છે. અર્થાત् તે મિદ્યાત્વી હોય કે સમ્યગ્દર્શની હોય, છદ્મસ્થ હોય કે કેવળી હોય, સંસારી (સશરીરી) હોય કે સિદ્ધ (અશરીરી) હોય- દ્વેક જીવને દ્રવ્યાત્મા હોય છે. આથી સમજાય છે કે તે દ્રવ્યાત્મા તે જ અમે ઉપર જણાવેલ શુદ્ધાત્મા (અશુદ્ધ જીવત્વભાવ અર્થાત् અશુદ્ધઃપે પરિણમેલ આત્મામાંથી અશુદ્ધિને ગૌણ કરતાં જ, જે જીવત્વરૂપ ભાવ શેષ રહે છે તે) છે અને તે જ શુદ્ધાત્માની વાત અમે આ પુસ્તકમાં કરેલ સમજવી. હવે આપણે તે જ વાત દ્રષ્ટાંતરી જોઈશું.

જેમ ડહોળાં પાણીમાં શુદ્ધ પાણી છુપાયેલ છે એવા નિશ્ચયથી જે કોઇ તેમાં ફટકડી (Alum) ફેરવે છે તો અમુક સમય બાદ તેમાં (પાણીમાં) રહેલ ડહોળરૂપ માટી તળિયે બેસી જવાથી, પૂર્વનું ડહોળું પાણી સ્વરચ્છરૂપ જણાય છે. તેવી જ રીતે,

જે અશુદ્ધરૂપ (રાગ-દ્રોષરૂપ) પરિણમેલ આત્મા છે તેમાં, વિભાવરૂપ અશુદ્ધભાવને બુદ્ધિપૂર્વક ગૌણ કરતાં જ જે શુદ્ધાત્મા (દ્રવ્યાત્મા) દ્યાનમાં આવે છે અર્થાત् જ્ઞાનમાં વિકલ્પરૂપે આવે છે, તેને ભાવભાસન કહે છે અને તે શુદ્ધાત્માની અનુભૂતિ થતાં જ જીવને સમ્યગ્દર્શન થાય છે અર્થાત્ તે જીવ તે શુદ્ધ આત્મરૂપમાં (સ્વરૂપમાં = સ્વભાવમાં) ‘હું પણું’ (એકત્વપણું = સ્વપણું) કરતાં જ, કે જે પહેલા શરીરમાં ‘હું પણું’ કરતો હતો, તે જીવને સમ્યગ્દર્શન થાય છે; આ રીત છે સમ્યગ્દર્શનની અર્થાત્ ‘જે જીવ રાગ-દ્રોષરૂપ પરિણમેલ હોવાં છતાં પણ માત્ર શુદ્ધાત્મામાં (દ્રવ્યાત્મામાં=સ્વભાવમાં) જ ‘હું પણું’ (એકત્વ) કરે છે અને તેનો જ અનુભવ કરે છે, તે જ જીવ સમ્યગ્દ્રષ્ટિ છે અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે.’

બીજું ક્રષ્ટાંત- જેમ દર્પણમાં (અરીસામાં) અલગ અલગ જાતનાં ઘણાં પ્રતિબિંબો હોય છે પરંતુ તે પ્રતિબિંબોને ગૌણ કરતાં જ સ્વરચ્છ દર્પણ ક્રષ્ટાંતમાં આવે છે તેવી જ રીતે આત્મામાં- જ્ઞાનમાં જે ઝોય હોય છે તે ઝોયોને ગૌણ કરતાં જ નિર્વિકલ્પરૂપ જ્ઞાનનો અર્થાત્ શુદ્ધાત્માનો અનુભવ થાય છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે. આ જ રીતથી અશુદ્ધ આત્મામાં પણ સિદ્ધ સમાન, શુદ્ધાત્માનો નિર્ણય કરવો અને તેમાં જ ‘હું પણું’ કરતાં, સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.

આત્મામાં બેદજ્ઞાન કઈ રીતે કરવું? તેનો ઉત્તર એમ છે કે-પ્રથમ તો પ્રગટમાં આત્માના લક્ષણાથી એટલે જ્ઞાનરૂપ જોવા-જાળવાના લક્ષણાથી આત્માને ગ્રહણ કરતાં જ પુરુષાલમાત્ર સાથે બેદજ્ઞાન થઈ જાય છે. અને પછી તેનાથી આગળ વધતાં, જીવના જે ઉદ્દ્યાદિભાવો કર્મની અપેક્ષાથી કછ્યાં છે, અને કર્મો પુરુષાલરૂપ જ હોવાથી, તે ઉદ્દ્યાદિભાવોને પણ પુરુષાલના ખાતામાં નાંખી, પ્રજ્ઞારૂપ બુદ્ધિથી શુદ્ધાત્માને ગ્રહણ કરવો અર્થાત् તે ઉદ્દ્યાદિભાવોને જીવમાંથી ગૌણ કરતાં જ જે જીવભાવ શેષ રહે છે, તે જ પરમપારિણામિકભાવ, શુદ્ધાત્મા, સ્વભાવભાવ, શુદ્ધ ચૈતન્યભાવ, કારણપરમાત્મા, દ્રગ્યાત્મા, સમ્યગ્દર્શનનો વિષય (દ્રષ્ટિનો વિષય) વગેરે અનેક નામોથી ઓળખાવાય છે અને તેના અનુભવે જ નિશ્ચય સમ્યગ્દર્શન કહેવાય છે. તે ભાવની અપેક્ષાએ જ ‘સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે’ એમ કહેવાય છે. તેના અનુભવને જ નિર્વિકલ્પ અનુભૂતિ કહેવાય છે કારણ કે તે સામાન્યભાવ સ્વરૂપ હોવાથી તેમાં કોઈ જ વિકલ્પને સ્થાન જ નથી. બેદ-જ્ઞાનની રીત આવી છે. અમે તો આ જ શુદ્ધાત્માને અનુભવીએ છીએ અને પરમસુખનો અનુભવ કરીએ છીએ. તો તેથી કરીને આપ પણ દ્રષ્ટિ બદલીને તેને જ શુદ્ધ જુઓ અને આપ પણ તેનો અર્થાત્ સત્ત-ચિત-આનંદ સ્વરૂપનો આનંદ લો, એવી અમારી વિનંતી છે. તે જ સમ્યગ્દર્શનનું સ્વરૂપ છે અને

તે જ સમ્યગ્દર્શનની રીત છે. પરંતુ જે અતે જળાવેલ ચુક્તિ અનુસાર સમ્યગ્દર્શનનો વિષય ન માનતાં અન્યથા ગ્રહણ કરે છે તે, શુદ્ધનયાભાષઃપ એકાંત શુદ્ધાત્માને શોધે છે અને માને છે, તે માત્ર બ્રહ્મઃપ જ પરિણામે છે. તેવો એકાંત શુદ્ધાત્મા કાર્યકારી નથી કારણ કે તેવો એકાંત શુદ્ધાત્મા, પ્રાપ્ત જ થતો નથી અને તેથી કરીને તે જીવ બ્રહ્મમાં જ રહીને અનંત સંસાર વધારીને અનંત દુઃખોને પ્રાપ્ત કરે છે.

સમ્યગ્દર્શન માટે અન્ય રીતે કહી શકાય કે-જેમ કોઈ મહેલના ઝરાખામાંથી નિહાળતો પુરાષ, પોતે જ જોયોને નિહાળે છે નહિ કે ઝરાખો; તે જ રીતે આત્મા, ઝરાખારૂપી આંખોથી જોયોને નિહાળે છે તે જ્ઞાયક-જાળવાવાળો પોતે જ, નહિ કે આંખો અને તે જ હું છું, સોહું, તે જ્ઞાનમાત્ર સ્વરૂપ જ હું છું અર્થાતું હું માત્ર જોવા-જાળવાવાળો જ્ઞાયક-જ્ઞાનમાત્ર-શુદ્ધાત્મા છું એવી ભાવના કરવી અને તેમ જ અનુભવવું.

જે સમયે મતિ અને શ્રુતજ્ઞાન એ બન્નેમાંથી કોઈ એક જ્ઞાનદ્વારા સ્વાત્માનુભૂતિ થાય છે તે સમયે એ બન્ને જ્ઞાન પણ અતિન્ક્રિયસ્વાત્માને પ્રત્યક્ષ કરે છે તેથી તે બન્ને જ્ઞાન પણ સ્વાત્માનુભૂતિના સમયમાં પ્રત્યક્ષઃપ છે પણ પરોક્ષ નથી. અર્થાતું સમ્યગ્દર્શન એ અનંતાનુંબંધી કષાય ચોકડી અને દર્શનમોહના ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયથી થાય છે, પરંતુ

તેની સાથે જ નિયમથી સમ્યક્જ્ઞાનરૂપ શુદ્ધોપયોગ ઉત્પત્તિ થતો હોવાથી તે શુદ્ધોપયોગને જ સ્વાત્માનુભૂતિ કહેવાય છે કે જે જ્ઞાનાપરણીયના ક્ષયોપશમરૂપ હોય છે અને તે શુદ્ધોપયોગ અર્થાત્ સ્વાત્માનુભૂતિ વિભાવ રહિત આત્માની અર્થાત્ શુદ્ધાત્માની હોવાથી તેને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ કહેવાય છે, અર્થાત્ સ્વાત્માનુભૂતિના કાળે મનોયોગ હોવાં છતાં ત્યારે મન પણ અતિન્દ્રિયરૂપે પરિણામવાથી તેને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ કહેવાય છે.

હવે અમે દ્યાન વિશે થોડુંક જણાવીએ છીએ. કોઈપણ વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ આદિ ઉપર મનનું એકાગ્રતાપૂર્વકનું ચિંતન દ્યાન કહેવાય છે. મનનું સમ્યગ્દર્શન માટે ખૂબજ મહત્વ છે અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય પણ મનથી જ ચિંતવાય છે, અને અતિન્દ્રિય સ્વાત્માનુભૂતિકાળે પણ તે ભાવમન જ અતિન્દ્રિય જ્ઞાનરૂપ પરિણામે છે. તેથી કરીને મન ક્યા વિષય ઉપર ચિંતન કરે છે અથવા મન ક્યા વિષયોમાં એકાગ્રતા કરે છે તેના ઉપર જ બંધ અને મોક્ષનો આધાર છે અર્થાત્ મન જ બંધ અને મોક્ષનું કારણ છે.

કર્મો મન-વચન-કાયાથી બંધાય છે, તેમાં સૌથી ઓછાં કર્મ કાયાથી બંધાય છે કારણ કે કાયાની શક્તિને એક સીમા છે જ્યારે વચનથી કાયા કરતાં અધિક કર્મોનો બંધ થાય છે અને

સૌથી વધારે કર્મોનો બંધ મનથી જ થાય છે કારણ કે મનને કોઈ જ સીમા નકટી નથી. અર્થાત્ મનનું બંધ અને મોક્ષમાં અગેરં મહત્વ છે, તેથી જ સર્વ સાધનાનો આધાર મન ઉપર જ છે અને મન ક્યા વિષય ઉપર ચિંતન કરે છે તે જાળવું અત્યંત આવશ્યક થઈ જાય છે કારણ કે તેનાથી જ આત્માની યોગ્યતા જળાય છે અને નવા કર્મોના બંધથી પણ બચી શકાય છે.

આ મનની એકાગ્રતારૂપ દ્યાન શુભ, અશુભ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારે હોય છે. તે દ્યાનનાં ચાર પ્રકારો છે, જેમ કે- આર્તદ્યાન, રૈદ્રદ્યાન, ધર્મદ્યાન અને શુક્લદ્યાન; તેનાં પણ ઘણાં પેટા પ્રકારો છે. મિથ્યાત્વી જીવોને આર્તદ્યાન અને રૈદ્રદ્યાન નામના બે અશુભ દ્યાન સહજ જ હોય છે કારણ કે તેવા જ દ્યાનનાં, આત્માને અનાદિના સંસ્કાર છે; છતાં તે પ્રયત્નપૂર્વક મનને અશુભમાં જતું અટકાવી શકે છે. તે અશુભમાં જતું અટકાવવાની આવી રીતો છે, જેમ કે- આત્મલક્ષે શાસ્ત્રોનો અભ્યાસ, આત્મરસપૂર્ણ ચિંતન, છ દ્રવ્યોના સમૂહરૂપ લોકનું ચિંતન, નવ તત્વોનું ચિંતન, ભગવાનની આજ્ઞાનું ચિંતન, કર્મ-વિપાકનું ચિંતન, કર્મની વિચિત્રતાનું ચિંતન, લોકના સ્વરૂપનું ચિંતન વગેરે તે કરી શકે છે. આવું મિથ્યાત્વી જીવોનું દ્યાન પણ શુભરૂપ ધર્મદ્યાન કહેવાય છે, નહિં કે શુદ્ધરૂપ ધર્મદ્યાન; તેથી તેને અપૂર્વ નિર્જરાનું કારણ માન્યું નથી કારણ કે અપૂર્વ નિર્જરા

માટે તે દ્વાન સમ્યગુર્દર્શન સહિત હોવું આવશ્યક છે અર્થાત્ શુદ્ધતૃપ ધર્મદ્વાન હોવું આવશ્યક છે. સમ્યગુર્દ્રષ્ટિને આ ઉપરાંત શુદ્ધાત્માનું દ્વાન મુખ્ય હોય છે કે જેથી કરી તે ગુણશ્રેણી નિર્જરા દ્વારા ગુણસ્થાનક આરોહણ કરતાં કરતાં આગળ શુક્લદ્વાનતૃપ અભિથી સર્વ ઘાતી કર્મોનો નાશ કરી, કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરે છે અને કાળે કરી સિદ્ધત્વને પામે છે.

અન્યમતિના દ્વાન, જેવાં કે- કોઈ એક બિંદુ ઉપર એકાગ્રતા કરાવે, તો કોઈ શ્વાસોશ્વાસ ઉપર એકાગ્રતા કરાવે અથવા તો અન્ય કોઈ રીતે, પણ જેનાથી દેહદ્વાન જ દ્રઢ થતો હોય એવાં કોઈપણ દ્વાન ખરેખર તો આર્તદ્વાનતૃપ જ છે. આવા દ્વાનથી મનને થોડીક શાંતિ મળતી હોવાથી લોકો છેતરાય જાય છે અને તેને જ સાચું દ્વાન માનવા લાગે છે. બીજું શ્વાસોશ્વાસ જોવાથી અને તેનો સારો અભ્યાસ હોય, તેને કષાયનો ઉદ્ભબ થાય તેની જાણ થવા છતાં, પોતે કોણ છે એનું સ્વાત્માનુભૂતિ પૂર્વકનું જ્ઞાન નહિ હોવાથી, આ બદાં દ્વાનનો આર્તદ્વાનતૃપ જ પરિણામે છે. તેવા આર્તદ્વાનનું ફળ છે તિર્યંચગતિ. જ્યારે કોઇ, માન, માયા-કપટતૃપ દ્વાન તે રૈદ્રદ્વાન છે અને તેનું ફળ છે નરકગતિ. ધર્મદ્વાનના પેટા પ્રકારોમાં પણ આત્મા જ કેન્દ્રમાં છે, તેથી જ તેને સમ્યકુદ્વાન કહેવાય છે.

કોઈએવું માનતાં હોય કે- સમ્યગુર્દર્શન દ્વાન વગર થતું નથી,

તો તેઓએ એ સમજવું આવશ્યક છે કે સમ્યગદર્શન બેદજાન વગર થતું જ નથી, દ્યાન વગર તો થાય છે. માટે સમ્યગદર્શન માટેની આવશ્યકતા તે દ્યાન નહિ, પરંતુ શાસ્ત્રોથી સારી રીતે બિર્હિત કરેલું તત્ત્વનું જ્ઞાન અને સમ્યગદર્શનના વિષયરૂપ શુદ્ધાત્માનું જ્ઞાન છે. તે શુદ્ધાત્મામાં ‘હું પણું’ કરતાં સ્વાત્માનુભૂતિરૂપ સમ્યગદર્શન પ્રગટે છે. તેથી આ માનવભવમાં જો કાંઈપણ કરવાં જેવું હોય તો, તે એક માત્ર નિશ્ચય સમ્યગદર્શન જ પ્રથમમાં પ્રથમ પ્રાપ્ત કરવા જેવું છે; જેથી કરીને પોતાને મોક્ષમાર્ગમાં પ્રવેશ મળે અને પુરુષાર્થ ફોરવતાં, આગળ સિદ્ધપદની પ્રાપ્તિ થાય કે જે અત્યાબાધ સુખસ્વરૂપ છે કે જેથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. સર્વજગતનોને આવા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય તેવી ભાવનાસહિત, જિનાજ્ઞા વિરદ્ધ અમારાથી કાંઈપણ લખાયું હોય તો ત્રિવિદે ત્રિવિદે અમારાં મિચામિ દુક્કડં!

ॐ શાંતિ! શાંતિ! શાંતિ!

નોંધ - જેઓને સમ્યગદર્શન વિશે વિસ્તારથી જાળવું હોય, તેઓને લેખકના અન્ય લેખો/પુસ્તક વાંચવા વિનંતિ છે.

અભયદાન, જ્ઞાનદાન, અન્તરદાન, ધનદાન, ઔષધદાનમાં અભયદાન અતિ શ્રેષ્ઠ છે. માટે સર્વેએ રોજિંદા જીવનમાં જયણા (દરેક કામમાં ઓછામાં ઓછી જીવ હિંસા થાય તેવી કાળજી) રાખવી અત્યંત આવશ્યક છે.

# સવારે ઉઠીને

નિત્ય સવારે સ્થૂરોદય પહેલાં ઉઠીને અર્થ સહિત નમસ્કાર મંત્ર ગણવા અને શક્ય હોય તો દરેક પદના ત્રણ એમ કુલ પંદર ખમાસણા-વંદણા (વંદના) કરવી. પછી પ્રતિક્રમણ કરવું. જો પૂર્ણ પ્રતિક્રમણ જેટલો સમય ન હોય તો અતે આપેલ ભાવ પ્રતિક્રમણ અવશ્ય કરવું. પ્રથમ સીમંઘરપ્રભુની આજા લઈને સામાચિક ધારણ કરવી અથવા ત્રણ નમસ્કાર મંત્ર ગણી ન પાળું ત્યાં સુધીનો સંવર ધારણ કરવો.

## ભાવ પ્રતિક્રમણ

નમો અરિહંતાણાં, નમો સિદ્ધાણાં, નમો આયરિયાણાં, નમો ઉવજાયાણાં, નમો લોએ સવ્પસાહૂણાં, એસો પંચ નમ્મોકારો, સવ્પ પાવ પણાસણો, મંગલાણાં ચ સવ્પેસિં, પઢ્મં હવદ્ય મંગલં.

તિક્ખુતો, આચાહિણાં, પચાહિણાં, વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કણાણાં, મંગલં, દેવચં, ચેદ્ધયં, પજ્ઞુપાસામિ, ઈરછામિ પડિક્કમિઉં. ઈરિયા વહિયાએ વિરાહણાએ. ગમણાગમણો, પાણક્કમણો, બીયક્કમણો, હરિયક્કમણો, ઓસા, ઉત્તિંગ, પણાગ, દગ્ગા, મણી, મક્કડા-સંતાણા સંકમણો, જે મે જીવા વિરાહિયા એંગિંદિયા, બેંદિયા, તેંદિયા, ચૌરિંદિયા, પંચિંદિયા. અભિહયા, વત્તિયા, લેસિયા,

સંઘાઈયા, સંઘઉિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્વિયા, ઠાણાઓ ઠાણાં સંકામિયા, જીવિયાઓ વવરોવિયા તરસ મિચામિ દુક્કડં. સ્વામીનાથ! પાપનું આલોચાણ કરવાને રાઈં (સાંજે દેવસિયં બોલવું) પ્રતિકમણાની આજા, ઈચ્છામિએં બંતે! તુબ્લેહિં અભભાણુણાએ સમાણે રાઈં (સાંજે દેવસિયં બોલવું) જ્ઞાન, દર્શન, ચરિતાચરિતે, તપ, અતિચાર ચિન્તપનાર્થી કરેમિ કાઉસગં નમો અરિહંતાણાં, નમો સિદ્ધાણાં, નમો આયરિયાણાં, નમો ઉવજજાયાણાં, નમો લોએ સપ્વસાહૂણાં, એસો પંચ નમ્મોકારો, સપ્વ પાવ પણાસણો, મંગલાણાં ચ અવેસિં, પઢ્મં હવઈ મંગલં.

પહેલા આવશ્યકની આજા! (એમ કહીને ઈશાન ખૂણામાં સીમંઘરપ્રભુને ત્રાણ વંદણા કરવી) કરેમિ બંતે! સામાઈં સાવજું જોગં પરચકખામિ જાવ નિયમં પજ્જુપાસામિ દુવિહં તિવિહેણાં ન કરેમિ, ન કારવેમિ મણસા વચસા કાચસા તરસ બંતે! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણાં વોસિરામિ. ઈચ્છામિ ઠામિ કાઉસગં જો મે રાઈઓ (સાંજે દેવસિયો બોલવું) અઈયારો કારો, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સુતો, ઉમગ્ગો, અકપ્પો, અકરણિઝો, દુજજાઓ, દુવ્યિચિંતિઓ, અણાચારો, અહિાચિછયવ્વો, અસાવગ પાઉગ્ગો, નાણો, તહ દંસણો, ચરિતાચરિતે, સુઅે, સામાયે, તિણું ગુતીણાં, ચઉણું કસાચાણાં, પંચણું માણુલ્યાણાં, તિણું

ગુણવ્યાણાં, ચઉણહું સિક્જાવયાણાં બારસ્સ વિહુસ સાવગ ધમ્મસ જે ખંડિયં, જે વિરાહિયં તસ્સ મિચામિ દુક્કડં! નવ્યાણું અતિચાર સંબંધી કોઈપણ પાપ-દોષ લાગ્યા હોય તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચામિ દુક્કડં!

બીજા આવશ્યકની આજા! લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મતિત્થયરે જિણે; અરિહંતે કિતાઇસં, ચઉવીસંપિ કેવલી. ઉસભમજિયં ચ વંદે, સંભવ મભિનંદણાં ચ સુમર્દીચ; પઉમપ્પહં સુપાસં, જિણાં ચ ચંદપ્પહં વંદે. સુવિહિં ચ પુષ્કદંતં, સીયલ-સિજ્જસ-વાસુપુરુંચ ચ; વિમલમણાંતં ચ જિણાં, ધમ્મં સંતિં ચ વંદામિ. કુંથું અરં ચ મહિં, વંદે મુહિસુવ્યયં નમિજિણાં ચ; વંદામિ રિઢુનેમિં, પાસં તહ વદ્યમાણાં ચ. એવં માએ અભિથુઆ, વિહુય રચ-મલા પહીણ જર-મરણા; ચઉવીસં પિ જિણાવરા, તિત્થયરા મે પસીચંતુ. કિતિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉતમા સિદ્ધા; આરૂગ બોહિલાભં, સમાહિ વર મુતમં દિંતુ. ચંદેસુ નિમ્મલયરા, આદીચ્યેસુ અહિયં પચાસયરા; સાગર વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ.

ત્રીજા આવશ્યકની આજા! ઈચ્છામિ ખમાસમણો! વંદિઉ જાવહિાજ્જાએ, નિસીહિયાએ, અણુજાણાહ મે મિઉગાહં નિસીહિ-અહોકાયં-કાયસંફાસં ખમાણાજો ભે! કિલામો અપ્પકિલંતાણાં, બહુ સુભેણાં ભે રાઈ (સાંજે દિવસો બોલવું) વદ્યક્કંતો? જતા

ભે? જવણિં ચ ભે? ખામેમિ ખમાસમણો! રાઈયં! (સાંજે દેવસિયં બોલવું) વઈક્કમં આવસ્તિસિયાએ પડિક્કમામિ ખમાસમણાણં, રાઈયે (સાંજે દેવસિયાએ બોલવું) આસાયણાએ તિર્તીસન્ધયરાએ જું કિંચિ મિરછાએ, મણ દુક્કડાએ, વય દુક્કડાએ, કાય દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોહાએ સવ્વ કાલિયાએ, સવ્વ મિરછોવયારાએ, સવ્વ ઘમાઈક્કમણાએ આસાયણાએ જો મે રાઈઓ (સાંજે દેવસિઓ બોલવું) અઈયારો કાંઈ તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિછામિ, અપ્પાણં વોસિરામિ. સ્વામીનાથ! સામાયિક એક, ચઉલીસત્થો બે અને વંદના ગ્રણા, એ ત્રણો આવશ્યક પૂરા થયા, તેને વિશે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડું, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓળું, અધિક, વિપરિત ભણાયું હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિરછામિ દુક્કડં!

ચોથા આવશ્યકની આજ્ઞા! જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિશે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું- એમ ભણતાં, ગણતાં, ચિંતવતાં ચૌટે પ્રકારે કોઈ પાપ-દોષ લાગ્યો હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિરછામિ દુક્કડં! અને સમકિત રૂપ રત્નને વિશે મિથ્યાત્વરૂપ ૨૪, મેલ, દોષ લાગ્યો હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિરછામિ દુક્કડં! હવે દરેક પાપોના

જે દોષ લાગ્યા હોય તે ચિંતવવા અને તેની માફી માંગવી. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મા-કામભોગ, પરિગ્રહ, ભોગ-ઉપભોગ, કર્મદાનના ધંધા, અનર્થદંડ, કોઘ, માન, માચા, લોખ, રાગ-છ્લેષ-કલહ, આળ-ચાડી-ચુગલી, કપટ, મિથ્યાત્વ- એમ સમકિત પૂર્વક બાર પ્રત, સંલેખણા સહિત અઢાર પાપસ્થાનક, પચ્ચીસ મિથ્યાત્વ, ચૌદ સ્થાનના સંમૂર્ચિષ્મ મનુષ્યની વિરાધના સંબંધી અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જાણતાં, અજાણતાં, મન, વચન, કાચાએ કરી સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમોદના કરી હોય તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તરસ્સ મિચામિ દુક્કડ!

શ્રી ગુરુજૈટેવની આજાથી! શ્રી સીમંઘરરસ્વામીની આજાથી! શ્રી શ્રી ચતારિ મંગલં, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાહૂ મંગલં, કેવલિ પત્રતો ધર્મો મંગલં, ચતારિ લોગુતમા, અરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહૂ લોગુતમા, કેવલિ પત્રતો ધર્મો લોગુતમા, ચતારિ સરણાં પવજ્ઞામિ, અરિહંતે સરણાં પવજ્ઞામિ, સિદ્ધે સરણાં પવજ્ઞામિ, સાહૂ સરણાં પવજ્ઞામિ, કેવલિ પત્રતો ધર્મમં સરણાં પવજ્ઞામિ ચાર શરણાા, દુઃખ હરણા, અપર શરણા નહિ કોય. જે ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચન પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવલજ્ઞાન. બોલો

શ્રી મહાવીરસ્વામી ભગવાન કી જ્ય! જૈનશાસન દેવ કી જ્ય!  
બોલો ભાઈ સબ સંતન કી જ્ય!

ચાર ગતિ, ચોવીસ દંડક, ચોરાશી લાખ જીવાયોનિ, એક  
કોડ સાડીસત્તાણું લાખ કુલ કોટિના જીવને મારા જીવે આરંભે,  
સમારંભે મન, વચન, કાયાએ કરી દુલભવ્યા હોય; દ્રવ્ય પ્રાણ-  
ભાવ પ્રાણ દુલભવ્યા હોય; પરિતાપના કિલામના ઉપજાવી  
હોય; કોધે, માને, માયાએ, લોભે, રાગે, દ્રેષે, હાસ્યે, ભયે,  
ખળાયે, ધીઠાયે, આપથાપનાએ, પરઉથાપનાએ, દુષ્ટ લેશ્યાએ,  
દુષ્ટ પરિણામે, દુષ્ટ દ્યાને-આર્ત-રૌદ્ર દ્યાને કરીને, ઈષ્યાએ,  
મમતે, છઠપણે, અવજ્ઞા કરી હોય; દુઃખમાં જોડચા હોય,  
સુખથી ચૂકવ્યા હોય; પ્રાણ, પર્યાય, સંજ્ઞા, ઈંક્રિય આદિ  
લબ્ધિ-અદ્ભુતી બ્રહ્મ કર્યા હોય; તો તે સર્વ મળી અઢાર લાખ,  
ચોવીસ હજાર, એકસો વીસ પ્રકારે પાપ-દોષ લાગ્યા હોય તો;  
અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તરસ મિચછામિ  
દુક્કડં! ખામેમિ સવ્યે જીવા, સવ્યે જીવા ખમંતુ મે, મિતી મે  
સવ્યભૂસેસુ, વેર મજરૂં ન કેણાઈ; એવં અહું આલોઈય, નિંદિયં,  
ગરહિયં, દુગંછિયં, સમ્મં તિવિહેણ પડિક્કડંતો, વંદામિ જિણ  
ચઉવ્યીસં. ઈતિ અતિચાર આલોવ્યા, પડિક્કમ્યા, નિંધા,  
નિઃશાલ્ય થયા. વિશેષ વિશેષ અરિહંત, સિદ્ધ, કેવળી આદિ,  
ગણાધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ, સાધ્વી, ગુર્વાદિકને  
ભુજો-ભુજો કરી ખમાવું છું, શ્રાવક-શ્રાવિકાજીઓને ખમાવું છું,

સમકિત બ્રહ્મજીવોને ખમાવું છું, ઉપકારી માતા-પિતા, ભાઈ-બહેનોને ખમાવું છું તથા ચોયશી લાખ જીવાયોનિના જીવોને ખમાવું છું.

પાંચમાં આવશ્યકની આજા! રાઈં (સાંજે દેવસિયં બોલવું) પાયચિછિત વિશુદ્ધનાર્થ કરેભિ કાઉસ્સગં. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજાયાણં, નમો લોએ સપ્વસાહૂણં, એસો પંચ નમ્મોકારો, સપ્વ પાવ પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. ચાર લોગસનો કાઉસ્સગ કરવો.

ઇઝા આવશ્યકની આજા! શક્તિ અનુસાર નિયમ વગેરે પ્રત્યાખ્યાન લેવાં. કોઈપણ પ્રત્યાખ્યાન-પરચ્છખાણ ધાર્ય પ્રમાણે, સીમંઘર ભગવંતની સાક્ષીએ ત્રણ નમરકાર મંત્ર ગળી લઈ શકાય છે. સ્વામીનાથ! સામાયિક એક, ચઉંબીસત્થો બે અને વંદણા ત્રણ, પ્રતિકમણ ચાર, કાઉસ્સગં પાંચ અને ઇઝા કર્યો પરચ્છખાણ. આ ઇએ આવશ્યક પૂરાં થયા, તેને વિશે શ્રી વીતરાગદેવની આજામાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓળું, અધિક, વિપરિત ભણાચું હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં!

મિથ્યાત્વનું પ્રતિકમણ, અપ્રતાનું પ્રતિકમણ, પ્રમાણનું પ્રતિકમણ, કષાયનું પ્રતિકમણ, અશુભ યોગનું પ્રતિકમણ-

આ સર્વ મળી બ્યાંસી બોલનું પ્રતિક્રમણા. એને વિશે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાળતાં, અજાળતાં, મન, વચન, કાચાએ કરી જે કોઈ પાપ-દોષ લાગ્યા હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તરસ મિરછામિ દુક્કડં!

ગયા કાળનું પ્રતિક્રમણા, વર્તમાન કાળનો સંવર અને આવતાં કાળના પરચ્યક્ખાણા. એને વિશે જે કોઈ પાપ-દોષ લાગ્યા હોય, તો અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ તરસ મિરછામિ દુક્કડં!

સમ, સંવેગ, નિર્ભેદ, અનુકુંપા અને આસ્થા. સાચાની શ્રદ્ધા, ખોટાનું વારંવાર મિરછામિ દુક્કડં. દેવ અરિહંત, ગુરુ નિર્ગંથ, કેવલી ભાષિત દયામય ધર્મ. આ ત્રણ તત્ત્વ સાર, સંસાર અસાર. ભગવંત! આપનો માર્ગ સત્ય છે. તમેવ સરચં! તમેવ સરચં! કરેભિ મંગલં, મહામંગલં, થવ થુઈ મંગલં.

પહેલું નમોત્થુણાં શ્રી સિદ્ધ ભગવંતોને કરું છું. નમોત્થુણાં! અરિહંતાણાં ભગવંતાણાં, આઈગરાણાં, તિત્થયરાણાં, સયં-સંબુદ્ધાણાં, પુરિસુતમાણાં, પુરિસ ભિહાણાં, પુરિસવર પુંડરિયાણાં, પુરિસવર ગંધ હત્થીણાં, લોગુતમાણાં, લોગ નાહાણાં, લોગ હિયાણાં, લોગ પઈવાણાં, લોગ પજોયગરાણાં, અભય દયાણાં, ચક્ખુ દયાણાં, મગ્ગ દયાણાં, સરણ દયાણાં, જીવ દયાણાં, બોહિ દયાણાં, ધ્રમ દયાણાં, ધ્રમ દેસયાણાં,

ધર્મ નાયગાણં, ધર્મ સારહીણં, ધર્મવર ચાઉરંત ચક્કવહીણં.  
 દીવો તાણં સરણ ગઈ પઈઝાણં, અપ્પડિહ્ય વર નાણા, દંસણ  
 ઘરાણં, વિયહુ છઉમાણં, જિણાણં-જાવયાણં, તિન્નાણં-  
 તારયાણં, બુઝાણં-બોહયાણં, મુતાણં-મોચગાણં, સવ્વન્નુણં-  
 સવ્વદરિસીણં, સિવ, મયલ, મરજ્ય, મળંત, મજ્જખ્ય,  
 મવ્યાબાહ, મપુણારાવિતિ, સિદ્ધિગઈ નામદેયં ઠાણં સંપત્તાણં,  
 નમો જિણાણં-જિય ભયાણં!

બીજું નમોતથુણં શ્રી અરિહંત ભગવંતોને કરું છું. નમોતથુણં!  
 અરિહંતાણં ભગવંતાણં, આઈગરાણં, તિત્થયરાણં,  
 સયં-સંબુઝાણં, પુરિસુતમાણં, પુરિસ સિહાણં, પુરિસવર  
 પુંડરિયાણં, પુરિસવર ગંધ હત્થીણં, લોગુતમાણં, લોગ  
 નાહાણં, લોગ હિયાણં, લોગ પઈવાણં, લોગ પઞ્ચોયગરાણં,  
 અભય દયાણં, ચક્ખ દયાણં, મગ્ગ દયાણં, સરણ દયાણં,  
 જીવ દયાણં, બોહિ દયાણં, ધર્મ દયાણં, ધર્મ દેસયાણં,  
 ધર્મ નાયગાણં, ધર્મ સારહીણં, ધર્મવર ચાઉરંત ચક્કવહીણં.  
 દીવો તાણં, સરણ ગઈ પઈઝાણં, અપ્પડિહ્ય વર નાણા, દંસણ  
 ઘરાણં, વિયહુ છઉમાણં, જિણાણં-જાવયાણં, તિન્નાણં-  
 તારયાણં, બુઝાણં-બોહયાણં, મુતાણં-મોચગાણં, સવ્વન્નુણં-  
 સવ્વદરિસીણં, સિવ, મયલ, મરજ્ય, મળંત, મજ્જખ્ય,  
 મવ્યાબાહ, મપુણારાવિતિ, સિદ્ધિગઈ નામદેયં ઠાણં સંપાવિઉ  
 કામાણં, નમો જિણાણં-જિય ભયાણં!

ત્રીજું નમોતથુણાં ધર્મગુરુ, ધર્મચાર્ય, ધર્મોપદેશક, સમ્યકૃત્વરૂપી બોધિબીજનાં દાતાર, જિનશાસનના શાણગાર એવી અનેક શુભ ઉપમાએ કરી બિરાજમાન જે જે સાધુ-સાધ્વીજીઓ વીતરાગદેવની આજ્ઞામાં જ્યાં જ્યાં વિચરતાં હોય, ત્યાં ત્યાં તેઓને મારી સમય સમયની વંદળા હોજો! સામાયિક પાળવી અથવા સંવર ત્રણા નમસ્કાર મંત્ર ગણી પાળવો.

સૂર્યાસ્ત વેળા પણ ઉપરોક્ત પ્રતિક્રમણ કરવું, પછી વાંચન, મનન, ચિંતન, ધ્યાન કરવું. તેમાં ચિંતવવું કે- આ દેહ તો ગમે ત્યારે છુટવાનો જ છે, તો તેની મમતા હમણાં જ કેમ ન છોડવી? અર્થાત્ દેહની મમતા તત્કાળ છોડવાં જેવી છે. મારી અનાદિની ચાત્રામાં આ દેહ તો માત્ર એક વિસામો જ છે, અને આ વિસામામાં જો હું મારં કામ ન કરી લઉં, તો પછી અનંતકાળ સુધી નંબર લાગે (વારો આવે) તેમ નથી. તેથી ભગવાને આ મારો છેલ્લો દિવસ છે, એમ જીવવા કર્છું છે. તેથી દેહ, પૈસા, પરિવારનો મોહ છોડી, માત્ર પોતાના આત્મા માટે જ ચિંતા, ચિંતન, મનન, ધ્યાન કરવાં જેવું છે- મારા આત્મા એ ચાર ગતિ, ચોવીસ દંડક, ચોર્યશી લાખ જીવાયોનિમાં અનાદિ કાળથી પરિષ્ઠમણ કરતા, અનંતા અનંત ભવો કર્યો, અનંતા જીવો સાથે સગપણ તથા સંબંધ બાંદ્યા અને સર્વને મારા કરી માન્યા, મમત્વભાવથી ઘણો પરિગ્રહ ભેગો કરી-મારો કરી માન્યો, પરંતુ આજથી મને પ્રભુ! આપની ફૂપાથી ભાન

થયું. તેથી તે સર્વેને અરિહંત, અનંતા સિદ્ધ ભગવંતોની સાક્ષીએ અંતઃકરણપૂર્વક મન, વચન, કાચાએ કરી વોસિરાવું છું! હવે મારે એ સર્વે સાથે કોઈ જ સંબંધ નથી. વોસિરામિ! વોસિરામિ!! વોસિરામિ!!! ત્રણ મનોરથ- આરંભ-પરિગ્રહ તજી કરી, ક્યારે થઉં પ્રતધર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. નિત્ય સૂતી વખતે સાગારી સંથારો ધારણ કરવો- આહાર, શરીરને ઉપધિ પચચફું પાપ અઢાર; મરણ આવે તો વોસિરે, જીવું તો આગાર.

**નોંધ-** નિત્ય સવાર-સાંજ માતા-પિતાને પ્રણામ કરવા. રજાના દિવસે આ પ્રતિક્રમણાના અર્થો સમજવા અને ચિંતવવા. જેઓને સવારે/સાંજે સમય ન મળે, તેઓ આ પ્રતિક્રમણ જ્યારે સમય મળે ત્યારે કરી શકે છે. બીજું, નિત્ય-જ્યારે પણ સમય મળે, નમસ્કાર મંત્રનું સ્મરણ કરવું. કોઈપણ શાસ્ત્ર વાંચતા યાદ રાખવું કે- આ હું મારા માટે વાંચું છું, આમાં જણાવેલ સર્વ ભાવો મારા જીવનમાં ઉત્તારવાના છે. ત્રીજું હંમેશા યાદ રાખવું કે-સારું તે જ મારું-સાચું તે જ મારું, નહિ કે મારું તે જ સારું-મારું તે જ સાચું; અને જે સાચું મળે, તે સ્વીકારવા તૈયાર રહેવું, ખોટી માન્યતાઓ છોડવા (બદલવા) તૈયાર રહેવું. મત-પંથ-સંપ્રદાય-વ્યક્તિ વિશેષનો આગ્રહ છોડી દેવો.

ધર્મ ન લજવાય તેને માટે સર્વ જૈનોએ પોતાનાં કુદુંબમાં, વ્યવસાયમાં-દુકાન, ઓફિસ વગેરેમાં તથા સમાજ સાથેનો પોતાનો વ્યવહાર સારો જ હોય તેનું દ્યાન રાખવું જરૂરી છે.

# સમાધિ મરણ ચિંતન

સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે મરણ એટલે શું અને ખરેખર મરણ કોનું થાય છે?

ઉત્તર- આત્મા તો અમર હોવાથી ક્યારેય મરણ પામતો જ નથી, પરંતુ ખરેખર આત્માનો પુદ્ગલરૂપ શરીર સાથેનો એકશેત્રવગાહ સંબંધનો અંત આવે છે, તેને જ મરણ કહેવાય છે. તેથી મરણ એટલે આત્માનું એક શરીર છોડી બીજા શરીરમાં જવું.

સંસારમાં કોઈ એક ઘર છોડી, બીજા સારા ઘરમાં રહેવાં જાય છે ત્યારે અથવા કોઈ જૂના કપડાં બદલાવી નવાં કપડાં પહેરે છે ત્યારે શોક કરતાં જણાતાં નથી. ટ્રેઇનમાં સર્વે પોત-પોતાનું સ્ટેશન આવતાં ઉતરી જાય છે, પરંતુ કોઈ તેનો શોક કરતાં જણાતાં નથી. તો મરણપ્રસંગે શોક કેમ થાય છે? તેનું સૌથી મોટું કારણ છે મોહ અર્થાત્ તેઓને મારા કરી માજ્યાં હતાં, તેથી શોક થાય છે. સૌ કોઈ જાણે છે કે- સર્વેને એક દિવસ આ દુનિયામાંથી જવાનું છે, છતાં પોતા વિશે ક્યારેય કોઈ વિચાર કરતાં નથી અને તેની માટેની અર્થાત્ સમાધિ મરણની તૈયારી પણ કરતાં નથી; તેથી સર્વેએ પોતાના સમાધિ મરણ વિશે વિચારી તેના માટેની તૈયારી કરવા ચોગ્ય છે.

તેથી પ્રજ્ઞન થાય કે સમાધિ મરણ એટલે શું અને તેની તૈયારી કેવી હોય? સમાધિ મરણ એટ લે એક માત્ર આત્મભાવે (આત્મામાં સમાધિભાવે) વર્તમાન ટેછને છોડવો. અર્થાત् હું આત્મા છું, એવા અનુભવ સાથેનું અર્થાત् સમ્યગ્દર્શન સહિતનાં મરણને સમાધિ મરણ કહેવાય છે અર્થાત્ સમાધિ મરણનું મહત્વ એટલે છે કે તે જીવ સમ્યગ્દર્શન સાથે લઈને જાય છે અન્યથા અર્થાત્ સમાધિ મરણ ન હોતાં તે જીવ સમ્યગ્દર્શન વમીને જાય છે. લોકો સમાધિ મરણની તૈયારી અર્થે સંથારાની ભાવના ભાવતાં જળાય છે, અંત સમયની આલોચના કરતાં/કરાવતાં જળાય છે, નિયોપકાચાર્યની (સંથારાનો નિર્વાહ કરાવનાર આચાર્યની) શોધ કરતાં જળાય છે; પરંતુ સમ્યગ્દર્શન કે જે સમાધિ મરણનો પ્રાણ છે તેના વિશે લોકો અજાણ જ હોય તેવું જળાય છે. તેથી સમાધિ મરણની તૈયારી અર્થે, આ પૂર્ણ જીવન એકમાત્ર સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ઉપાયમાં જ લગાવવું યોગ્ય છે. કારણ કે સમ્યગ્દર્શન વગર અનંતીવાર બીજું બધું જ કરવાં છતાં આત્માનો ઉદ્ઘાર શક્ય બન્યો નથી, ભવખ્ભમણાનો અંત આવ્યો નથી. અર્થાત્ સમ્યગ્દર્શન વગર ગમે તે ઉપાય કર્યાથી, કદાચ એક-બે, થોડાક ભવો સારાં મળી પણ જાય છતાં, ભવકટી થતી નથી અને તેથી કરીને અનંત દુખોનો અંત આવતો નથી અર્થાત્ નરક / નિગોદના નદાવા (acquaintance =

હવે પછી એ જીવ ક્યારેય નરક / નિગોદમાં જવાનો નથી) થતાં નથી. માટે આવાં દુર્લભ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે અને તૈયારીઓ આ સંસાર પ્રત્યેનો ધૈરાગ્ય, સંસારનાં સુખો પ્રત્યેની ઉદાસીનતા અને શાસ્ત્ર સ્વાદ્યાયથી યથાર્થ તત્ત્વનો નિર્ણય આવશ્યક છે.

આ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે, તેથી તેનો ઉપયોગ શેમાં કરવો તે વિચારવું અત્યંત આવશ્યક છે. કારણ કે જેવું જીવન જીવશો પ્રાય: તેવું જ મરણ હોય છે, માટે નિત્ય જાગૃતિ જરૂરી છે. જીવનમાં નીતિ-ન્યાય આવશ્યક છે, નિત્ય સ્વાદ્યાય, મનન, ચિંતન આવશ્યક છે; કારણ કે આચુષ્યનો બંધ ગમે ત્યારે પડી શકે છે અને ગતિ અનુસાર જ મરણ વખતે લેશ્યા હોય છે. તેથી જેઓ સમાધિ મરણ દરિષ્ટા હોય તેઓએ પૂર્ણજીવન સમ્યગ્દર્શન સહિત ધર્મમય જીવવું આવશ્યક છે. તેથી જીવનભર સર્વ પ્રયત્નો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે જ કરવાં ચોગ્ય છે, કારણ કે સમ્યગ્દર્શન અર્થે કરેલ સર્વ શુભભાવ યથાર્થ છે અન્યથા તે ભવકટી માટે અયથાર્થ નિવડે છે અને તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બાદ પણ પ્રમાદ સેવવાં ચોગ્ય નથી કારણ કે એક સમયનો પણ પ્રમાદ નહિ કરવાની ભગવાનની આજ્ઞા છે.

સર્વેએ માત્ર પોતાના જ પરિણામ ઉપર બ્રહ્મિં રાખવાં જેવી

છે અને તેમાં જ સુધારો ઈરછવો. ‘બીજા શું કરે છે ?’ અથવા ‘બીજા શું કહેશે ?’ વગેરે ન વિચારતાં પોતા માટે શું ચોગ્ય છે, તે વિચારવું આર્તિક્યાન અને રૌદ્રદ્વાનનાં કારણો ન સેવવાં અને જો ભૂલથી, અનાદિનાં સંસ્કારપશ આર્તિક્યાન અથવા રૌદ્રદ્વાન થયું હોય તો તરત જ તેમાંથી પાછા ફરવું (પ્રતિક્રમણ), તેનો પસ્તાવો કરવો (આલોચના) અને ભવિષ્યમાં આવું ફરી ક્યારેય ન થાય (પરચફ્ખાણ) તેવો ક્રદ્ધ નિર્ધાર કરવો. આવી રીતે દુદ્દાનથી બચી, પૂર્ણ યત્ન સંસારના અંતનાં કારણોમાં જ લગાવવાં ચોગ્ય છે. આવી જાગૃતિ જીવનભર માટે જરૂરી છે, ત્યારે જ મરણ સમયે જાગૃતિ સહિત સમાધિ અને સમત્વભાવ રહેવાની સંભાવના રહે છે કે જેથી સમાધિ મરણ થઈ શકે. સર્વજનોને આવું સમાધિ મરણ પ્રાપ્ત થાય તેવી ભાવનાસહ, જિનાજ્ઞા વિરાઙ્ક અમારાથી કાંઈપણ લખાયું હોય તો ત્રિવિદ્યે ત્રિવિદ્યે અમારાં મિરછામિ દુક્કડં!

ॐ શાંતિ! શાંતિ! શાંતિ!

આત્માર્થિએ દંબથી હંમેશા દ્વારા જ રહેવું જોઈએ અર્થાત્ તેણે મન-વચન અને કાચાની એકતા સાધવાનો અભ્યાસ નિરંતર કરતાં જ રહેવો જોઈએ અને તેમાં અડચણારૂપ સંસારથી બચતા રહેવું જોઈએ.

# કંદમૂળ વિશે

આપણો પૂર્વે જોયું કે કંદમૂળ ભક્ષણાથી અનંત પાપ લાગે છે, તો કોઈને પ્રશ્ન થાય કે એવું કેમ છે? તેનું કારણ (logic) શું છે?

**ઉત્તર-** આપણો પૂર્વે જોયું તેમ જે આપણો બીજાને આપીએ તે જ આપણાને પ્રાપ્ત થાય છે. તેથી આપણો આપણા જીવન-ગુજરાનમાં, જે બીજા જીવોને દુઃખ આપીએ છીએ તે જ આપણાને પાછું (reciprocate) મળશે. જેમ કે જ્યારે આપણો પ્રત્યેક વનસ્પતિનો ભોજનમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે તેમાં સંખ્યાત જીવો હોવાથી જેટલું પાપ લાગે છે તેનાં કરતાં કંદમૂળ અર્થાત् અનંતકાય વનસ્પતિનો ભોજનમાં ઉપયોગ કરવાથી, તેમાં અનંતા જીવો હોવાથી, અનંતગણું પાપ લાગે છે અને તેથી તેનાથી અનંતા દુઃખો આવે છે.

આથી જ કહ્યું છે કે પૂર્ણજીવનમાં પ્રત્યેક વનસ્પતિકાયનો ભોજનમાં ઉપયોગ કરવાથી જે પાપ લાગે છે તેનાથી અનંતગણું પાપ કંદમૂળ અર્થાત् અનંતકાય વનસ્પતિનો એક ટુકડો ખાવાથી લાગે છે. કારણ કે તે કંદમૂળ અર્થાત् અનંતકાયના એક ટુકડામાં અસંખ્યાત પ્રતર (layer) હોય છે, તેવાં એક પ્રતરમાં અસંખ્યાત શ્રેણી (line) હોય છે, તેવી એક શ્રેણીમાં અસંખ્યાત ગોળા

(ball) હોય છે, તેવાં એક ગોળામાં અસંખ્યાત શરીર (body) હોય છે અને તેવાં એક શરીરમાં અર્થાત् કંદમૂળ-અનંતકાય-નિગોદના એક શરીરમાં અનંતાનંત જીવો હોય છે. એ અનંતાનંત અર્થાત્ કેટલાં?

**ઉત્તર-** સર્વે સિદ્ધોથી અનંતા-અનંત ગણા. તેથી કહી શકાય કે કંદમૂળ અર્થાત્ અનંતકાયના એક ટુકડામાં અસંખ્યાત X અસંખ્યાત X અસંખ્યાત X અનંતાનંત જીવો હોય છે. તેથી સુખનાં અથી જીવોએ તે કંદમૂળના વપરાશથી બચવું જોઈએ કારણ કે તે અનંતા દુઃખનું કારણ બનવાં સક્ષમ છે અર્થાત્ તેનાં વપરાશથી અનંતા પાપકર્મો બંધાય છે કે જે અનંતા દુઃખનું કારણ બનવાં સક્ષમ છે. અસ્તુ!

આત્માથીને કોઈ પણ મત-પંથ-સંપ્રદાય-વ્યક્તિવિશેષજ્ઞો આગ્રહ, છઠાગ્રહ, કદાગ્રહ, પૂર્વગ્રહ અથવા પક્ષ ન જ હોવો જોઈએ કારણ કે તે આત્માને માટે અનંતકાળની બેડી સમાન છે અર્થાત્ તે આત્માને અનંતકાળ રખડાવનાર છે. આત્માથીને માટે ‘સારું તે મારું અને સાચું તે મારું’ હોવું અતિ આવશ્યક છે કે જેથી કરીને તે આત્માથી પોતાની ખોટી માન્યતાઓને છોડીને સત્યને સરળતાથી ગ્રહણ કરી શકે અને તે જ તેની યોગ્યતા કહેવાય છે.

# રાત્રિભોજન વિશે

રાત્રિભોજનનો ત્યાગ મોક્ષમાર્ગના પથિક માટે તો આવશ્યક છે જ પરંતુ તેના આધુનિક વિજ્ઞાન પ્રમાણે પણ અનેક ફાયદાઓ છે. જેમ કે રાત્રે નવ વાગ્યે શરીરની ઘડિયાળ (body clock) પ્રમાણે પેટમાં રહેલ વિષારી તત્ત્વોની સફાઈનો (detoxification) સમય હોય છે, ત્યારે પેટ જો ભરેલું હોય તો શરીર તે કાર્ય કરતું નથી (skip કરે છે) અર્થાત્ પેટમાં કચરો વધે છે પરંતુ જેઓ રાત્રિભોજન કરતાં નથી તેઓનું પાચન નવ વાગ્યા સુધીમાં થઈ ગયું હોવાથી તેમનું શરીર વિષારી તત્ત્વોની સફાઈનું કાર્ય સારી રીતે કરી શકે છે. બીજું, રાત્રે જમ્યા પણી બે થી ત્રણ કલાક સુધી સૂપાનું વર્જય છે અને તેથી જેઓ રાત્રે મોકેથી જમે છે તેઓ રાત્રે મોડાં સૂવે છે. પરંતુ રાત્રે અગિયારથી એક વાગ્યા દરમિયાન ઘેરી ઊંઘ (deep sleep) લીવરની સફાઈ અને તેની નુકસાન ભરપાઈ (cell regrowth) માટે અત્યંત આવશ્યક છે કે જે રાત્રિભોજન કરવાવાળા માટે શક્ય નથી, તેથી તે પણ રાત્રિભોજનનું મોટું નુકસાન છે. આરોગ્યની ક્રષ્ણા આ સિવાય પણ રાત્રિભોજન ત્યાગના બીજા અનેક ફાયદાઓ છે.

આયુર્વેદ, યોગશાસ્ત્ર અને જૈનેતર દર્શન અનુસાર પણ

રાત્રિભોજન વર્જય છે. જૈનેતર દર્શનમાં તો રાત્રિભોજનને માંસ ખાવા સમાન અને રાત્રે પાણી પીવાને લોહી પીવા સમાન જળાવેલ છે અને બીજું, રાત્રિભોજન કરવાવાળાના સર્વ તપ-જપ-જાત્રા એ સર્વ ફોક થાય છે અને રાત્રિભોજનનું પાપ સેંકડો ચંદ્રાયતન તપથી પણ ધોવાતું નથી એમ જળાવેલ છે.

જૈન દર્શન અનુસાર પણ રાત્રિભોજનનું ઘણું પાપ જળાવેલ છે. અતે કોઈ એમ કહે કે રાત્રિભોજન ત્યાગ વગેરે પ્રતો અથવા પડિમાઓ(પ્રતિમાઓ) તો સમ્યગ્દર્શન બાદ જ હોય છે તો અમોને તે રાત્રિભોજનનો શો દોષ લાગે? તો તેઓને અમારો ઉત્તર છે કે રાત્રિભોજનનો દોષ સમ્યગ્દ્રહિટ કરતાં મિથ્યાદ્રહિટને અધિક જ લાગે છે કારણ કે મિથ્યાદ્રહિટ તેને રાચી- માચીને સેવતો (કરતો) હોય છે જ્યારે સમ્યગ્દ્રહિટ તો આવશ્યક ન હોય, અનિવાર્યતા ન હોય તો આવાં દોષોનું સેવન જ નથી કરતો અને જો કોઈ કાળે આવાં દોષોનું સેવન કરે છે તો પણ ભીરભાવે અને રોગના ઔષધ તરીકે કરે છે, નહિ કે આનંદથી અથવા સ્વરચ્છંટે. આથી કોઈપણ પ્રકારનો છળ કોઈ એ ધર્મશાસ્ત્રોમાંથી ગ્રહણ ન કરવો કારણ કે ધર્મશાસ્ત્રોમાં દરેક વાતો અપેક્ષાએ હોય છે. તેથી કરીને પ્રતો અને પડિમાઓ(પ્રતિમાઓ) પાંચમાં ગુણસ્થાનકે કહી છે. તેનો અર્થ એવો ન કાઢવો કે અન્ય કોઈ નિમ્ન ભૂમિકાવાળાંઓ તેને

અભ્યાસ અર્થે અથવા તો પાપથી બચવા ગ્રહણ ન કરી શકે. બલ્કે સૌઅે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય જ છે કારણ કે જેને દુઃખ પ્રિય નથી એવા જીવો દુઃખના કારણારૂપ પાપો કેવી રીતે આચરી શકે ? અર્થાત્ ન જ આચરી શકે.

અસ્તુ!

આત્માર્થીએ એક જ વાત દ્યાનમાં રાખવા જેવી છે કે આ મારા જીવનનો છેલ્લો દિવસ છે અને જો આ મનુષ્યભવમાં મેં આત્મપ્રાપ્તિ ન કરી તો હવે અનંત, અનંત, અનંત..... કાળ પણી પણ મનુષ્યજન્મ, પૂર્ણ ઈન્ડ્રિયોની પ્રાપ્તિ, આર્થ દેશ, ઉત્ત્યકુળ, ધર્મની પ્રાપ્તિ, ધર્મની દેશના વગેરે મળે તેમ નથી, પરંતુ અનંત, અનંત, અનંત..... કાળ પર્યત અનંત, અનંત, અનંત..... દુઃખો જ મળશે. તેથી આ અમૂલ્ય-દુર્લભ મનુષ્યજન્મ માત્ર શારીરિક-ઈન્ડ્રિયજન્ય સુખ અને તેની પ્રાપ્તિ પાછળ ખર્યવા જેવો નથી, પરંતુ તેની એકપણ પળને વ્યર્થ ન ગુમાવતાં, માત્રને માત્ર, ત્વરાએ શાશ્વત સુખ એવા આત્મિક સુખની પ્રાપ્તિ અર્થે જ લગાવવાં યોગ્ય છે.

# બાર ભાવના

- અનિત્ય ભાવના-** સર્વે સંયોગો અનિત્ય છે, તે કોઈ જ મારી સાથે નિત્ય રહેવાવાળાં નથી, તેથી તેનો મોહ ત્યાગવો-તેમાં ‘હું પણું’ અને મારાપણું ત્યાગવું.
- અશરણ ભાવના-** મારા પાપોના ઉદયવેળાં મને માતા-પિતા, પતની-પુત્ર, પૈસો વગેરે કોઈ જ શરણ થઈ શકે તેમ નથી, તેઓ મારું દુઃખ લઈ શકે તેમ નથી, તેથી તેઓનો મોહ ત્યાગવો-તેઓમાં મારાપણું ત્યાગવું પરંતુ ફરજ પૂરેપૂરી બજાવવી.
- સંસાર ભાવના-** સંસાર એટલે સંસરણ-રખડપણી અને તેમાં એક સમયનાં સુખની સામે અનંતકાળનું દુઃખ મળે છે; તો એવો સંસાર કોને ગમે? અર્થાત્ એક માત્ર લક્ષ સંસારથી છુટવાનું જ રહેવું જોઈએ.
- એકટ્ય ભાવના-** અનાદિથી હું એકલો જ રખણું છું, એકલો જ દુઃખ ભોગવું છું; મરણ સમયે મારી સાથે કોઈ જ આવવાનું નથી, તો મારે શક્ય હોય તેટલું પોતામાં જ (આત્મામાં જ) રહેવાનો પ્રયત્ન કરવો.
- અન્યત્વ ભાવના-** હું કોણ છું? તે ચિંતવવું અર્થાત્ પૂર્વે જણાવ્યાં અનુસાર પુદ્ગાલ અને પુદ્ગાલ (કર્મ) આશ્રિત

ભાવોથી પોતાને જુદ્દો ભાવવો અને તેમાં જ ‘હું પણું’ કરવું, તેનો જ અનુભવ કરવો, તેને જ સમ્યગ્દર્શન કહેવાચ છે. તે જ આ જીવનનું, એક માત્ર કર્તવ્ય હોવું જોઈએ.

- **અશુચિ ભાવના-** મને, મારાં શરીરને સુંદર બતાવવાનાં જે ભાવ છે અને વિજાતીયનાં શરીરનું આકર્ષણ છે, તે શરીરની ચામડીને હટાવતાં જ માત્ર માંસ, લોહી, પરં, મળ, મૂત્ર વગેરે જ જગ્યાય છે કે જે અશુચિરૂપ જ છે; એવું ચિંતવી પોતાનાં શરીરનો અને વિજાતીયનાં શરીરનો મોહ ત્યજવો, તેમાં મૂંજાવું (મોહિત થવું) નહિ.
- **આસ્વચ ભાવના-** પુણ્ય (શુભ) અને પાપ (અશુભ), એ બન્ને મારા (આત્મા) માટે આસ્વચ છે; તેથી વિવેક કરી પ્રથમ પાપોનો ત્યાગ કરવો અને એક માત્ર આત્મપ્રાપ્તિના લક્ષે શુભભાવમાં રહેવું કર્તવ્ય છે.
- **સંવર ભાવના-** સાચા (કાર્યકારી) સંવરની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એક માત્ર સાચા સંવરના લક્ષે દ્રવ્યસંવર પાળવો.
- **નિર્જરા ભાવના-** સાચી (કાર્યકારી) નિર્જરાની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, તેથી તેના લક્ષે પાપોનો ત્યાગ કરી, એક માત્ર સાચી નિર્જરાના લક્ષે યથાશક્તિ તપ આચરવું.

- **લોકસ્વરૂપ ભાવના-** પ્રથમ લોકનું સ્વરૂપ જાળાવું, પછી ચિંતવનું કે હું અનાદિથી આ લોકમાં સર્વે પ્રદેશે અનંતીવાર જનમ્યો અને મરણ પામ્યો; અનંતા દુઃખો ભોગવ્યાં, હવે ક્યાં સુધી આ ચાલુ રાખવું છે? અર્થાત્ તેના અંત માટે સમ્યગ્દર્શન આવશ્યક છે, તો તેની પ્રાપ્તિનો ઉપાય કરવો. બીજું, લોકમાં રહેલ અનંતા સિદ્ધ ભગવંતો અને સંખ્યાતા અરિહંત ભગવંતો અને સાધુ ભગવંતોને વંદણા કરવી, અને અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાજીઓ તથા સમ્યગ્દ્રષ્ટિ જીવોની અનુમોદના કરવી, પ્રમોદ કરવો.
- **બોધિ દુર્લભ ભાવના-** બોધિ એટલે સમ્યગ્દર્શન, અનાદિથી આપણી રખડપણીનું જો કોઈ કારણ હોય તો તે છે સમ્યગ્દર્શનનો અભાવ; તેથી સમજાય છે કે સમ્યગ્દર્શન કેટલું દુર્લભ છે, કોઈક આચાર્ય ભગવંતે તો કહ્યું છે કે- વર્તમાન કાળમાં સમ્યગ્દ્રષ્ટિ, આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ હોય છે.
- **ધર્મસ્વરૂપ ભાવના-** વર્તમાન કાળમાં ધર્મસ્વરૂપમાં ઘણી વિકૃતિઓ પ્રવેશી ચૂકેલ હોવાથી, સત્યધર્મની શોધ અને તેનું જ ચિંતન કરવું; સર્વ પુરુષાર્થ તેને પામવામાં લગાવવો.

## નિત્ય ચિંતન કરિકાઓ

- ◆ એક સમકિત પાએ બિના, તપ-જપ-કિયા ફોક;  
જેસા મુદ્દા સિનગારના, સમજ કહે તિલોક.  
અર્થાત્ - સમ્યગદર્શન વગરની સર્વ કિયા-તપ-જપ-શ્રાવકપણું-કૃષ્ણકપણું-સાધુપણું વગેરે મદદાને શાણગારવાં જેવું નિરર્થક છે. અતે કહેવાનો ભાવાર્થ એ છે કે આવાં સમ્યગદર્શન વગરની કિયા-તપ-જપ-શ્રાવકપણું-કૃષ્ણકપણું-સાધુપણું ભવનો અંત કરવાં કાર્યકારી નથી અર્થાત્ તે ન કરવું એમ નહિ, પરંતુ તેમાં જ સંતોષાઈન જવું અર્થાત્ તેનાથી જ પોતાને કૃત-કૃત્ય ન સમજતાં, સર્વપ્રયત્ન એક માત્ર નિશ્ચય સમ્યગદર્શનની પ્રાપ્તિ અર્થે જ કરવાં.
- ◆ ભગવાનનાં દર્શન કર્ય રીતે કરવાં? ભગવાનનાં ગુણોનું ચિંતન કરવું અને ભગવાન, ભગવાન બનવા જે માર્ગ ચાલ્યાં તે માર્ગ ચાલવાનો ફ્રઢ નિર્ધાર કરવો તે જ સાચા દર્શન છે.
- ◆ સંપૂર્ણ સંસાર અને સાંસારિક સુખો પ્રત્યેના વૈરાગ્ય વગર અર્થાત્ સંસાર અને સાંસારિક સુખોની રૂચિ સહિત મોક્ષમાર્ગની શરૂઆત થવી અત્યંત દુર્લભ છે અર્થાત્ સમ્યગદર્શનની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે.

- ◆ જીવને ચાર સંજ્ઞા/સંસ્કાર-આહાર, મૈથુન, પરિગ્રહ અને ભય અનાદિથી છે, તેથી તેના વિચારો સહજ હોય છે. તેવાં વિચારોથી જેને છૂટકારો જોઈતો હોય તેઓએ પોતાનો તેના તરફનો ગમો તપાસવો અર્થાત્ જ્યાં સુધી આ સંજ્ઞાઓ ગમે છે અર્થાત્ તેમાં સુખ ભાસે છે, જેમકે- ફૂતરાને હાડકું ચૂસવા આપતાં તેને તે તાળવામાં ઘસાતાં લોહી નીકળે છે, કે જેને તે એમ સમજે છે કે લોહી હાડકામાંથી નીકળે છે અને તેથી તેને તેનો આનંદ થાય છે કે જે માત્ર તેનો બ્રમ જ છે. આ રીતે જ્યાં સુધી આ આહાર, મૈથુન, પરિગ્રહ અને ભય અર્થાત્ બળવાનનો કર અને નબળાને કરાવવા/ દબાવવા ગમે છે ત્યાં સુધી તે જીવને તેના વિચારો સહજ હોય છે અને તેથી તેના સંસારનો અંત થતો નથી. તેથી મોક્ષેચુંએ આ અનાદિના ઉલટા સંસ્કારોને મૂળથી કાઢવાનો પુરુષાર્થ આદરવાનો છે કે જેના માટે સર્વપ્રથમ આ સંજ્ઞાઓ પ્રત્યેનો આદર નીકળવો આવશ્યક છે, તેથી સર્વ પુરુષાર્થ તેઓ પ્રત્યે ઐરાગ્ય થાય તેના માટે જ લગાવવો આવશ્યક છે કે જેના માટે સદ્ગ્રાંચન અને સાચી સમજણ આવશ્યક છે.
- ◆ તમને શું ગમે છે? આ છે આત્મપ્રાપ્તિનું બેરોમીટર. આ પ્રશ્નનો ઉત્તર ચિંતવવો. જ્યાં સુધી ઉત્તરમાં કોઈ પણ

સાંસારિક ઇચ્છા/આકંસા હોય ત્યાં સુધી પોતાની ગતિ સંસાર તરફની સમજવી અને જ્યારે ઉત્તર- એક માત્ર આત્મપ્રાપ્તિ, એવો હોય તો સમજવું કે આપના સંસારનો કિનારો બહુ નજીક આવી ગયેલ છે. માટે તે માટેનો પુરુષાર્થ વધારવો.

- ◆ તમને શું ગમે છે? આ છે તમારી ભક્તિનું બેરોમીટર. અર્થાત્ ભક્તિમાર્ગની વ્યાખ્યા એ છે કે જે આપને ગમે છે, તે તરફ આપની સહજ ભક્તિ સમજવી. ભક્તિમાર્ગ એટલે વેવલાંવેડાંરૂપ અથવા વ્યક્તિરાગરૂપ ભક્તિ ન સમજવી, પરંતુ જે આપને ગમે છે અર્થાત્ જેમાં આપની રૂચિ છે તે તરફ જ આપની પૂર્ણ શક્તિ કામે લાગે છે; તેથી જેને આત્માની રૂચિ જાગી છે અને માત્ર તેનો જ વિચાર આવે છે, તેની પ્રાપ્તિના જ ઉપાયો વિચારાય છે, તો સમજવું કે મારી ભક્તિ યથાર્થ છે અર્થાત્ હું સાચા ભક્તિમાર્ગ છું. અર્થાત્ જ્યાં સુધી તમને શું ગમે છે તેના ઉત્તરમાં કોઈ પણ સાંસારિક ઇચ્છા/આકંસા હોય અથવા કોઈ વ્યક્તિ હોય ત્યાં સુધી પોતાની ભક્તિ સંસાર તરફની સમજવી અને જ્યારે ઉત્તર- એક માત્ર આત્મપ્રાપ્તિ, એવો હોય તો સમજવું કે આપના સંસારનો કિનારો બહુ નજીક આવી ગયેલ છે. અર્થાત્ ભક્તિ એટલે સંવેગ સમજવો કે

જે વૈરાગ્ય અર્થાતું નિર્વેદ સહિત જ આત્મપ્રાપ્તિ માટે કાર્યકારી છે.

- ◆ પૈસા પુણ્યથી પ્રાપ્ત થાય છે કે મહેનતથી અર્થાતું પુરુષાર્થથી?

ઉત્તર - પૈસાની પ્રાપ્તિમાં પુણ્યનો ફાળો અધિક છે અને મહેનત અર્થાતું પુરુષાર્થનો ફાળો ઓછો છે. કારણ કે જેનો જન્મ પૈસાપાત્ર કુદુંબમાં થાય છે તેને, કોઈપણ પ્રયત્ન વગર જ પૈસા પ્રાપ્ત થાય છે અને ઘણા લોકો ઘંઘામાં ઘણી મહેનત કરવાં છતાં પણ, પૈસા ગુમાવતાં જણાય છે. પૈસા કમાવવા માટે પ્રયત્ન આવશ્યક છે, પરંતુ કેટલો? કારણ કે ઘણાં લોકોને બહુ ઓછાં પ્રયત્નને વધારે પૈસા પ્રાપ્ત થતાં જણાય છે, જ્યારે કોઈને ઘણાં પ્રયત્ન છતાં ઓછાં પૈસા પ્રાપ્ત થતાં જણાય છે; તેથી એ નિશ્ચિત થાય છે કે પૈસા પ્રયત્ન કરતાં પુણ્યને અધિક વરેલાં છે. તેથી જેને પૈસા માટે મહેનત કરવી આવશ્યક લાગતી હોય તેઓ એ પણ વધારેમાં વધારે અર્દો સમય જ અર્થોપાર્જનમાં અને ઓછામાં ઓછો અર્દો સમય તો ધર્મમાં જ લગાવવાં ચોગ્ય છે કારણ કે ધર્મથી અનંત કાળનું દુઃખ ટળે છે અને સાથે સાથે પુણ્યનાં કારણે પૈસા પણ સહજ જ પ્રાપ્ત થાય છે. જેમ ઘઉં વાવતાં સાથે ઘાસ આપમેળે જ પ્રાપ્ત થાય છે, તેમ સત્યધર્મ કરતાં

પાપો હળવાં બને છે અને પુણ્ય તીવ્ર બને છે તેથી ભવકટીની સાથે સાથે પૈસો અને સુખ આપમેળે જ પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં અવ્યાબાધ સુખરૂપ મુક્તિ મળે છે.

- ◆ પુરુષાર્થથી ધર્મ થાય અને પુણ્યથી પૈસા મળે. અર્થાતું પૂર્ણ પુરુષાર્થ ધર્મમાં લગાવવો અને પૈસા કમાવવામાં ઓછામાં ઓછો સમય વેદફક્તવો કારણ કે તે મહેનતના અનુપાતમાં (proportionate = પ્રમાણ) નથી મળતાં પરંતુ પુણ્યના અનુપાતમાં મળે છે.
- ◆ કર્મોનો જે બંધ થાય છે, તેનાં ઉદ્યકાળે આત્માનાં કેવાં ભાવ થશે અર્થાતું તે કર્મોનાં ઉદ્યકાળે નવાં કર્મો કેવાં બંધાશે તેને અનુબંધ કહે છે; તે અનુબંધ અભિપ્રાયનું ફળ છે, માટે સર્વ પુરુષાર્થ અભિપ્રાય બદલાવવાં લગાવવો અર્થાતું તેને સમ્યકું કરવામાં લગાવવો.
- ◆ સ્વરૂપથી હું સિદ્ધસમ હોવાં છતાં, રાગ-છ્રેષ્ઠ મારાં કલંક સમાન છે તેને ઘોવાનાં (ટાળવાનાં) દ્યેયપૂર્વક, ધગશ, અને દૈર્યસહિત ધર્મપુરુષાર્થ આદરવો.
- ◆ સંતોષ, સરળતા, સાદગી, સમતા, સહિષ્ણુતા, સહનશીલતા, નમૃતા, લધુતા, વિવેક જીવનમાં કેળવવાં અત્યંત આવશ્યક છે.
- ◆ તપસ્યામાં નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય અતિ શ્રેષ્ઠ છે.

- ◆ સંસારી જીવો નિમિત્તવાસી હોય છે. કાર્યરૂપ તો નિયમથી ઉપાદાન જ પરિણામે છે, પરંતુ તે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરી અવિનાભાવે હોય જ છે; અર્થાતું વિવેકે કરી મુમુક્ષુજીવ સમજે છે કે કાર્ય ભલે માત્ર ઉપાદાનમાં થાય, પરંતુ તેથી કરીને તેઓને સ્વરચંદ્રે કોઈપણ નિમિત્ત સેવનનો પરવાનો નથી મળી જતો અને તેથી જ તેઓ નબળા નિમિત્તોથી ભીરૂભાવે દૂર જ રહે છે.
- ◆ સાધક આત્માએ ટી.વી., સિનેમા, નાટક, મોબાઇલ, ઇન્ટરનેટ વગેરે જેવાં નબળા નિમિત્તોથી દૂર જ રહેવું આવશ્યક છે, કારણ કે ગમે તેટલાં સારાં ભાવોને ફરી જતાં વાર નથી લાગતી. બીજું આ બધાં જ નબળા નિમિત્તો અનંત સંસાર અર્થાતું અનંત દુઃખની પ્રાપ્તિના કારણ બનવાં સક્ષમ છે.
- ◆ માતા-પિતાના ઉપકારોનો બદલો બીજુ કોઈ રીતે વાળી શકાતો નથી, એક માત્ર તેઓને ધર્મ પમાડીને જ વાળી શકાય છે. તેથી માતા-પિતાની સેવા કરવી. માતા-પિતાનો સ્વભાવ અનુકૂળ ન હોય તો પણ તેઓની સેવા પૂરેપૂરી કરવી અને તેઓને ધર્મ પમાડવાં, તેના માટે પ્રથમ પોતે ધર્મ પામવો આવશ્યક છે.

- ◆ અપેક્ષા, આગ્રહ, આસક્તિ, અહુંકાર કાઢી નાખવાં અત્યંત આવશ્યક છે.
- ◆ સ્વદોષ જોવો, પર દોષ નહિ, પર ગુણ જોવો અને તે ગ્રહણ કરવો અત્યંત આવશ્યક છે.
- ◆ અનાદિની ઈન્ડ્રિયોની ગુલામી છોડવા જેવી છે.
- ◆ જે ઈન્ડ્રિયોનાં વિષયોમાં જેટલી આસક્તિ વધારે, જેટલો જે ઈન્ડ્રિયોનો દુર-ઉપયોગ વધારે; તેટલી તે ઈન્ડ્રિયો ભવિષ્યમાં અનંતકાળ સુધી મળવાની સંભાવનાં ઓછી.
- ◆ મારા જ કોઈ, માન, માયા, લોભ મારા કહૂર શાન્ત છે, બાકી વિશ્વમાં મારો કોઈ શાન્ત જ નથી.
- ◆ એક એક કષાય અનંત પરાવર્તન કરાવવા શક્તિમાન છે અને મારામાં તે કષાયોનો વાસ છે, તો મારં શું થશે? માટે ત્વરાએ સર્વ કષાયોનો નાશ ઈચ્છવો અને તેનો જ પુરુષાર્થ આદરવો.
- ◆ અહુંકાર અને મમકાર અનંત સંસારનું કારણ થવા સક્ષમ છે, તેથી તેનાથી બચવાનાં ઉપાય કરવાં.
- ◆ નિંદા માત્ર પોતાની કરવી અર્થાત્ પોતાના દુર્ગુણોની જ કરવી, બીજાના દુર્ગુણો જોઈને સૌ પ્રથમ પોતે પોતાનાં ભાવ તપાસવા અને જો તે દુર્ગુણો પોતામાં હોય તો કાઢી

નાંખવાં અને તેમના પ્રત્યે ઉપેક્ષાભાવ અથવા કરણાભાવ રાખવો કારણ કે બીજાની નિંદાથી તો આપણાને ઘણો કર્મબંધ થાય છે અર્થાતું કોઈ બીજાના ઘરનો કચરો પોતાના ઘરમાં ઠાલવતાં નથી જ, તેમ બીજાની નિંદા કરવાથી તેમના કર્મો સાફ થાય છે જ્યારે મારા કર્મોનો બંધ થાય છે.

- ◆ ઈષ્ટ કરવી હોય તો માત્ર ભગવાનની જ કરવી અર્થાતું ભગવાન બનવા માટે ભગવાનની ઈષ્ટ કરવી, અન્યથા નહિ; એ સિવાય કોઈની પણ ઈષ્ટ કરવાથી અનંત દુઃખ દેવાવાળા અનંત કર્મોનો બંધ થાય છે અને જીવ વર્તમાનમાં પણ દુઃખી થાય છે.
- ◆ જાગૃતિ - છર સમયે રાખવી અથવા કલાકે-કલાકે પોતાના મનનાં પરિણામની ચકાસણી કરતાં રહેવી, તેનું વલણ કઇ તરફ છે તે જોવું અને તેમાં જરૂરી સુધારા કરવાં. લક્ષ એક માત્ર આત્મપ્રાપ્તિ જ રાખવું અને તે ભાવ દ્રઢ કરતાં રહેવો.
- ◆ અનંતકાળ સુધી રહેવાનાં બે જ સ્થાનો છે- એક, સિદ્ધાચવસ્થા અને બીજું, નિગોદ. પહેલામાં અનંત સુખ છે અને બીજામાં અનંત દુઃખ છે, આથી પોતાના ભવિષ્યને લક્ષમાં લેતાં સર્વેજનોએ પોતાના સર્વ પ્રયત્નો અર્થાતું પુરાષાર્થ એકમાત્ર મોક્ષાર્થે જ કરવા યોગ્ય છે.

- ◆ જે થાય તે સારા માટે-એમ માનવું. જેથી કરી આર્તદ્યાન અને રૈદ્રદ્યાનથી બચી શકાય છે. અર્થાત્ નવાં કર્મોના આસ્વધી બચી શકાય છે.
- ◆ મારે કોનો પક્ષ-કોની તરફેણ કરતાં રહેવી? અર્થાત્ મારે ક્યો સંપ્રદાય અથવા ક્યા વ્યક્તિવિશેષની તરફેણ કરતાં રહેવી? ઉત્તર- માત્ર પોતાની જ અર્થાત્ પોતાના આત્માની જ તરફેણ કરતાં રહેવી કારણ કે તેમાં જ મારો ઉદ્ઘાર છે, અન્ય કોઈની તરફેણ (પક્ષ) નહિ કારણ કે તેમાં મારો ઉદ્ઘાર નથી, નથી, ને નથી જ કારણ કે તે તો રાગદ્રેષનું કારણ થાય છે પરંતુ જ્યારે પોતાના આત્માની જ તરફેણ કરવામાં આવે ત્યારે તેમાં સર્વે જ્ઞાનીની તરફેણ સમાય જાય છે.
- ◆ જૈન કહેવાતાં લોકોએ રાત્રિના કોઈપણ કાર્યક્રમ-ભોજન સમારંભ ન રાખવાં જોઈએ. કોઈપણ પ્રસંગે ફૂલ અને ફટાકડાંનો ઉપયોગ ન કરવો જોઈએ.
- ◆ લગ્ન એ સાધક માટે મજબૂરી હોય છે, નહિ કે ઉજાણી કારણ કે જે સાધકો પૂર્ણ બ્રહ્મચર્ય ન પાળી શકતાં હોય તેમને માટે લગ્ન-વ્યવસ્થાનો સહારો લેવા ચોગ્ય છે કે જેથી કરીને સાધક પોતાનો સંસાર, નિર્વિદ્ધને શ્રાવકદ્યર્મ અનુસાર વ્યતિત કરી શકે અને પોતાની મજબૂરી પણ ચોગ્ય મર્યાદા સહિત પૂરી

કરી શકે. આવાં લગ્ના ઉજવણાં ન હોય કારણ કે કોઈ પોતાની મજબૂરીને ઉત્સવ બનાવી, ઉજાણી કરતાં જણાતા નથી. તેથી સાધકે લગ્ન બહુજ જરરી હોય તો જ કરવાં અને તે પણ સાદાદથી. બીજું, અતે જણાવ્યા અનુસાર લગ્નને મજબૂરી સમજુને કોઈએ લગ્ન-દિવસ વગેરેની ઉજાણી કરવા જેવી નથી અર્થાત્ તે દિવસે વિશેષ ધર્મ કરવા જેવો છે અને એવી ભાવના ભાવો કે હવે મને આ લગ્નરૂપ મજબૂરી ભવિષ્યમાં ક્યારેય ન હજો! કે જેથી કરી હું ત્વરાએ આત્મકલ્યાણ કરી શકું અને સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકું.

- ◆ જન્મ એ આત્માને અનાદિનો લાગેલ ભવરોગ છે, નહિ કે ઉજાણી કારણ કે જેને જન્મ છે તેને મરણ અવશ્ય છે અને જન્મ-મરણાનું દુઃખ અનંતુ હોય છે અર્થાત્ જ્યાં સુધી આત્માની જન્મ-મરણરૂપ ઘટમાળ ચાલે છે, ત્યાં સુધી તેને અનંત દુઃખોથી છૂટકારો મળતો નથી અર્થાત્ દરેકે એક માત્ર સિદ્ધત્વ અર્થાત્ જન્મ-મરણથી કાયમ માટેનો છૂટકારો દર્શાવા ચોગ્ય છે. તેથી આવાં જન્મના ઉજવણાં ન હોય કારણ કે કોઈ પોતાના રોગને ઉત્સવ બનાવી, ઉજાણી કરતાં જણાતાં નથી. તેથી સાધકે અતે જણાવ્યા અનુસાર જન્મને અનંત દુઃખાનું કારણ એવો ભવરોગ સમજુને, જન્મ-દિવસ વગેરેની ઉજાણી કરવા જેવી નથી

અર્થાત् તે દિવસે વિશેષ ધર્મ કરવા જેવો છે અને એવી ભાવના ભાવો કે હવે મને આ જન્મ કે જે અનંત દુઃખોનું કારણ એવો ભવરોગ છે, તે ભવિષ્યમાં ક્યારેય ન હોજો! અર્થાત् સાધકે એક માત્ર સિદ્ધત્વની પ્રાપ્તિ અર્થે અર્થાત્ અજન્મા બનવા અર્થે જ સર્વ પુરુષાર્થ લગાવવાં જેવો છે.

- ◆ ઈન્દ્રસ્થ આત્માના પ્રત્યેક પ્રદેશે અનંત કર્મવર્ગાણાઓ હોવાથી તે અશુદ્ધ આત્મા તરીકે જ પરિણમેલ હોય છે, તો તેમાં આ શુદ્ધાત્મા કયાં રહે છે? તેનો ઉત્તર એમ છે કે- ભેદજ્ઞાનથી (પ્રજ્ઞાછીણીથી) અર્થાત્ જીવ અને પુરુષાલ વરચેના ભેદજ્ઞાનથી અર્થાત્ જીવના લક્ષણથી જીવને ગ્રહણ કરવો અને પુરુષાલના લક્ષણથી પુરુષાલને અને પછી તેમાં પ્રજ્ઞારૂપીછીણીથી (તીવ્ર બુદ્ધિથી) વિભાવને ગૌણ કરી ભેદજ્ઞાન કરતાં જ શુદ્ધાત્મા પ્રાપ્ત થાય છે.
- ◆ જો કોઈ કહે કે- આત્મા બહારથી અશુદ્ધ અને અંદરથી શુદ્ધ તો તેવું કથન અપેક્ષાએ સમજવું, એકાંતે અર્થાત્ વાસ્તવિક રૂપ નહીં કારણ કે જેવો આત્મા બહાર છે તેવો જ અંદર છે, અર્થાત્ આત્માના અંદરના અને બહારના પ્રત્યેક પ્રદેશો (ક્ષેત્રો) અનંતાનંત કાર્માણિવર્ગાણાઓ ક્ષીર-નીરવત લાગેલી હોવાથી, જેવી અશુદ્ધિ બહારના ક્ષેત્રો છે તેવી જ અશુદ્ધિ અંદરના ક્ષેત્રો પણ છે. પરંતુ અપેક્ષાએ બહાર એટલે વિશેખભાવરૂપ વિભાવભાવ અને અંદર એટલે

સામાજ્યભાવરૂપ પરમપારિણામિક ભાવ કે જે ત્રણે કાળે શુદ્ધ જ છે અને તેથી જ વ્યક્તતરૂપ આત્મા અશુદ્ધ અને અવ્યક્તતરૂપ આત્મા શુદ્ધ છે અને તે અપેક્ષાએ અંદરથી શુદ્ધ અને બહારથી અશુદ્ધ એમ કહી શકાય અન્યથા નહિ. કોઈ આત્મામાં અંદર એકાંત શુદ્ધ ધૂપભાવ શોધતું હોય તો, તેવો એકાંત શુદ્ધ ધૂપભાવ આત્મામાં નથી અર્થાતું કોઈપણ કથન તેની અપેક્ષા સહિત સમજવું અનિવાર્ય છે, નહિ તો એવું માનવાવાળા નિયમથી બ્રમરૂપ જ પરિણામશે.

- ◆ નવ તત્ત્વોથી લિન્ન સર્વથા શુદ્ધદ્રવ્યની સિદ્ધિ થઈ શકતી નથી, માટે કોઈએ તેવા બ્રમમાં રહેવાની જરૂર નથી કે પર્યાયથી લિન્ન સર્વથા શુદ્ધ દ્રવ્ય ઉપલબ્ધ થશે કારણે કે સાધનનો અભાવ હોવાથી એ શુદ્ધ દ્રવ્યની ઉપલબ્ધિ થઈ શકતી નથી પરંતુ કેવળ નવ તત્ત્વ સંબંધી વિકારોને બાદ કરતાં અર્થાતું ગૌણા કરતાં જ એ શુદ્ધાત્મા છે.
- ◆ કોઈપણ પ્રત્યાખ્યાન-પરચ્યક્ખાણ ધાર્યો પ્રમાણો, સીમંઘર ભગવંતની સાક્ષીએ ત્રણ નમર્કાર-મંત્ર ગણી લેવાં અને દરેક પ્રત્યાખ્યાન-પરચ્યક્ખાણમાં અજાણપણાંના, અસમાધિનાં, તબિયત નિમિત્તે દવાનાં અને અન્ય કોઈપણ ઉપસર્ગના આગાર એમ ધારી રાખવું. કોઈપણ જીતના પ્રત્યાખ્યાન-પરચ્યક્ખાણ પાળવાની વિધિ-જે (પ્રત્યાખ્યાનનું નામ બોલવું) પ્રત્યાખ્યાન-પરચ્યક્ખાણ

કર્યો હતાં તે પૂરાં થતાં પાળું છું. સમકાએણાં, ન ફાસિયં, ન પાલિયં, ન તિરિયં, ન કિહિયં, ન સોહિયં, ન આરાહિયં, આણાએ આણુપાલિયં ન ભવઈ તસ્સ મિરછામિ દુક્કડં! ત્રણ નમસ્કાર-મંત્ર ગણવાં.

- ◆ ઘણાં સાધકોનો પ્રશ્ન હોય છે કે તમને આત્માનો અનુભવ થયો ત્યારે શું થયેલ? અર્થાત્ આત્માના અનુભવ કાળે શું થાય? તેઓને અમારો ઉત્તર છે કે- સ્વાત્માનુભૂતિકાળે શરીરથી બિન્ન એવો સિદ્ધસદસ આત્માનો અનુભવ થાય જેમાં શરીરનો કોઈપણ જાતનો અનુભવ ન હોય જેમ કે- ઘણાં સાધકો અમને પ્રશ્ન કરતાં હોય છે કે અમને પ્રકાશમય આત્માનો અનુભવ થયો અથવા કોઈ કહે છે કે- અમે એકદમ હળવાં ફૂલ જેવાં થઈ ગયાં હોઈએ તેવો અનુભવ થયો અથવા કોઈ કહે છે કે- અમે રોમાંચિત થઈ ગયા, વગેરે. તો આવા સાધકોને અમે જણાવીએ છીએ કે- આવા ભ્રમોથી છેતરાવા જેવું નથી કારણ કે સ્વાત્માનુભૂતિકાળે શરીરનો કોઈપણ જાતનો અનુભવ હોતો જ નથી માત્ર સિદ્ધસદસ આત્માનો જ અનુભવ હોય છે અર્થાત્ અંશે સિદ્ધત્વનો જ અનુભવ હોય છે અને પછી આત્મા બાબત કોઈપણ પ્રશ્ન રહેતો જ નથી એટલો સ્પષ્ટ અનુભવ હોય છે. અર્થાત્ સ્વાત્માનુભૂતિ બાદ શરીરથી ભેદજાન વર્તતું હોય છે, દા.ત.

સ્વાત્માનુભૂતિ બાદ આપ દર્પણાની સામે જ્યારે પણ જાઓ ત્યારે આપ કોઈ ત્રાહિત વ્યક્તિને નિહાળતા હો એવો ભાવ આવે છે.

- ◆ કોઈ અમ માને કે મુમુક્ષુ જીવને ચોગ્યતા એના કાળે થઈ જશો, તેના માટે પ્રયત્નની જરૂર નથી; તો તેઓને અમે પ્રશ્ન કરીએ છીએ કે આપ જીવનમાં પૈસો, પ્રતિષ્ઠા, પરિવાર વગેરે માટે પ્રયત્ન કરો છો? કે પછી આપ કહો છો કે તે એના કાળે આવી જશો, બોલો આવી જશો? તો ઉત્તર અપેક્ષિત જ મળે છે કે અમો તેના માટે પ્રયત્ન કરીએ છીએ. તો અમે પ્રશ્ન કરીએ છીએ કે જે વસ્તુ અથવા સંયોગો કર્મો અનુસાર આપ મેળે આવીને મળવાના છે તેના માટે આપ ખૂબજ પ્રયત્ન કરો છો પરંતુ જે આત્માના ઘરનો છે એવો પુરુષાર્થ અર્થાત્ પ્રયત્નપૂર્વક આત્માના ઉદ્ધાર માટે ઉપર જણાવેલ તથા અન્ય આચરणો જીવનમાં કરવામાં ઉપેક્ષા સેવો છો. તો આપ જૈન સિદ્ધાંતની અપેક્ષા ન સમજતાં તેને અન્યથા જ સમજયા છો એવું જ કહેવું પડશે કારણ કે જૈન સિદ્ધાંત અનુસાર કોઈપણ કાર્ય થવા માટે પાંચ સમવાયનું હોવું આવશ્યક છે અને તેમાં આત્મસ્વભાવમાં પુરુષાર્થ એ ઉપાદાન કારણ હોઈને જે આપ તેની અવગણાના કરી માત્ર નિમિત્તની રાહ જોતાં બેસી રહેશો અથવા નિયતિ સામે જોઈ બેસી રહેશો તો આત્મપ્રાપ્તિ થવી અત્યંત કરીન છે. તેથી કરીને દરેક

મુમુક્ષુ જીવે પોતાનો પુરુષાર્થ અધિકમાં અધિક આત્મર્થ  
ક્ષેત્રે પ્રવર્તાવવો આવશ્યક છે અને થોડોક (અલ્પ) જ  
કાળ જીવનની જરૂરીયાતોને અજીર્ણ કરવામાં નાંખવો તે  
પ્રથમ આવશ્યકતા છે.

◆ અનાદિથી પુરુષાલના મોહમાં અને તેના માટેની જ  
મારામારીમાં જીવ દંડાતો આવ્યો છે અર્થાત્ તેના મોહના  
ફળરૂપે તે અનંતા દુઃખો ભોગવતો આવ્યો છે, તેથી ત્વરાએ  
પુરુષાલનો મોહ છોડવા જેવો છે. તે માત્ર શબ્દમાં નહિ, જેમ  
કે- ધર્મની ઊંચી ઊંચી વાતો કરવાવાળાં પણ પુરુષાલના  
મોહમાં ફસાયેલાં જણાય છે અર્થાત્ આ જીવ અનાદિથી  
આવી જ રીતે પોતાને છેતરતો આવ્યો છે તેથી સર્વે  
આત્માથીને અમારી વિનંતી છે કે આપે આપના જીવનમાં  
અત્યંત સાદઈઅપનાવી પુરુષાલની જરૂરિયાત બને તેટલી  
ઘટાડવી અને જાવજીવ દ્રેક જાતના પરિગ્રહની મર્યાદા  
કરવી અર્થાત્ સંતોષ કેળવવો પરમ આવશ્યક છે કે જેથી  
પોતે એકમાત્ર આત્મપ્રાસિના લક્ષ માટે જ જીવન જીવી શકે  
કે જેથી તે પોતાના જીવને અનંતા દુઃખોથી બચાવી શકે છે  
અને અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરી શકે છે.

આ પુસ્તકમાં અમારી કાંઈપણ ભૂલ-ચૂક થઈ હોય તો આપ સુધારીને  
વાંચશો અને અમારાથી જિનાજ્ઞા વિરલ્લ કાંઈપણ લખાયું હોય તો અમારાં  
ત્રિવિદે ત્રિવિદે મિશામિ દુક્કડં!



# યુનિવર્સિટ લો

- ◆ યુનિવર્સિટ લો સર્વને સમાનરૂપે લાગુ પડતી બ્રહ્માંડની સંચાલન વ્યવસ્થા.
- ◆ મેં જે આપ્યું છે, તે જ મને મળે છે. હું જે બીજા માટે ઈચ્છિશ, તેવું મારી સાથે થશે.
- ◆ હું આત્મા છું. આ શરીર એ મને મળેલ ભૂમિકા (Role) છે. સામાન્યપણે, આપણાને જેનું અત્યંત આકર્ષણ હોય તેવી જ ભૂમિકા આપણાને મળે છે.
- ◆ મારી સાથે જે કાંઈપણ થાય છે તે મારા ભૂતકાળનો અરીસો છે. એ મારા પૂર્વકૃત કર્મોનું જ ફળ છે. મેં જે કાર્ય મન-વચન-કાયાથી ન કર્યું હોય, ન કરાવ્યું હોય, ન અનુમોદન કર્યું હોય તેવું કાર્ય મારી સાથે કદી નહીં બને.
- ◆ તેથી એક વાત નક્કી જ છે કે મારી સાથે ભૂતકાળમાં, વર્તમાનમાં અથવા ભવિષ્યમાં કોઈ પણ અન્યાય થયો નથી, થતો નથી અને થશે પણ નહીં. આવી સમજણ થવાથી હું કોઈપણ ફરિયાદ વગર (No Complaint Zone) જીવી શકીશ. મારી સાથે જે પણ થાય છે તે મારા ભૂતકાળના કારણે જ થાય છે. તેથી મારી સાથે જ કેમ? એ પ્રશ્ન જ ઉદ્ભબતો નથી.
- ◆ હું મારં સદનસીબ (Good Luck) પુણ્ય કરીને અને મોટા પાપોનો (જુગાર, દાર, માંસાહાર, વેશ્યાગમન, ચોરી, શિકાર, વ્યભિચાર, કંદમૂળ ભક્ષણ, રાત્રિ ભોજન, અથાણાં, મધ, અંજીર, માખણ વગેરે) ત્યાગ કરીને બનાવી શકું છું.
- ◆ આ સમીકરણ યાદ રાખવું પાપ = દુખ અને પુણ્ય = સુખ.

- ◆ આ વાત અવશ્ય ચાદ રાખો મારે દુખમાંથી પણ ફાયદો લેતાં શીખવાનું છે.
  - ◆ હું અહિંયા કોઈપણ શર્ત અથવા અપેક્ષા વગર આપવા આવ્યો છું. આ રીતે આપીને હું કાં તો માં જૂનું દેણું ચૂકવી રહ્યો છું અથવા તો મારી નવી જમાપૂંજી બનાવી રહ્યો છું. બંને સંજોગોમાં ફાયદો મારો જ છે.
  - ◆ મારે મારી ફરજ ઉત્તમ રીતે બજાવવાની છે, બીજા પણ એવું જ કરે એવા આગ્રહ વગર. આપણે બધાએ આપણા કુટુંબ, ભિત્રો, સહકર્મીઓ, સમાજ અને દેશ પ્રત્યેની આપણી ફરજ સર્વોત્કૃષ્ટ શક્તિ મુજબ બજાવવાની છે.
- આપણે આપણી જાત પ્રત્યે કડક અને બીજા પ્રત્યે ઉદાર/ દચાળુ બનવાનું છે.
- ◆ જે થાય છે તે સારા માટે. આ સર્વોપરિ સકારાત્મકતાનો રસ્તો છે.
  - ◆ લોકો સાથેના મારા પ્રતિભાવ આ ચાર રીતના હોવાં જોઈએ  
 ૧) મૈત્રી - સર્વ જીવો સાથે મૈત્રી. આથી મારા કોઈ દુશ્મન નહીં રહે. ભિત્રોનું સારં (હિત) દર્શયાથી મારં હિત થશે, આ રીતે મારી ખુશી જળવાઈ રહેશે.  
 ૨) પ્રમોદભાવ - બીજાના ગુણોની પ્રશંસા કરવાથી તે ગુણો મારામાં ખીલી જશે.  
 ૩) કરુણા - પાપીઓ પ્રત્યે કરુણા રાખવી કારણ કે તેઓને બ્રહ્માંડના નિયમની ખબર નથી. તેનાથી મારો મનોભાવ સારો રહેશે.  
 ૪) મધ્યસ્થતા / કોઈ જ પ્રતિભાવ નહીં - જ્યારે કોઈ આપણને દુખ આપે ત્યારે મૌન અને શાંત રહેવું અને હૃદયમાં આભાર!

**સ્વાગત!** (Thank you! Welcome!)ના ત્રણા ચરણાનું ચિંતન કરવું.

**પ્રથમ ચરણ :** મારી પૂર્વની ભૂલો માટે હું ક્ષમા માંગું છું. (Sorry! Sorry!)

**બીજું ચરણ :** હું નક્કી કરું છું કે આવું બીજા સાથે હું કદી નહીં કરું. (Never again)

**ત્રીજું ચરણ :** સામેવાળી વ્યક્તિને મને સ્વર્ચછ કરવાવાળી ઉપકારી માનીને હું મનમાં ધન્યવાદ આપીશ (Thank you). જેથી મને ગુસ્સો, અણાગમો, નિરાશા વગેરે નહીં આવે. તેથી મારી ખુશી જળવાશે કે જે સ્વાગતયોગ્ય વાત છે (Welcome!). આમ કરવાથી હું અન્યો પ્રત્યેના છેખ / અણાગમાના વિષયકમાંથી બચી જઈશ. આ રીતે હું નકારાતમક વિચારોથી બચીને સકારાત્મક વિચારોમાં પ્રવૃત્ત રહી શકીશ.

- ◆ મારે મારી વૃત્તિમાં ફેરફાર સમજણાથી કરવાનો છે દબાણાથી નહીં. તેથી આ સહજ યોગ છે, હઠ યોગ નથી.
- ◆ મારે મારા શરીર અને મનનો ઉપયોગ મુક્તિ માટે કરવાનો છે. તેના માટે સર્વપ્રથમ સમ્યગ્દર્શન જરૂરી છે. તેથી મારા આ જીવનનું પહેલું દ્યેય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જ છે. તેના માટે સૌથી પહેલાં સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ આવશ્યક છે, નહીં કે ઘર, પરિવાર, પૈસાનો ત્યાગ. મારે મારી ઈચ્છાઓને અને અણાગમાને દર બે કલાકે તપાસીને, તેનો 12/4 ભાવનાથી મૂળમાંથી નાશ કરવાનો છે.
- ◆ સત્ય મારી અંદર જ છે. તેને શોધવા મારે ક્યાંચું બહાર જવાની જરૂર નથી.

- ◆ જેમણે સત્યનો અનુભવ કર્યો છે, તે જ બીજાને તે રાહ બતાવી શકે છે. આવી વ્યક્તિ કચારેય પોતાની જાતને દુનિયાની ઝાકમઝોળમાં લાવતી નથી. તેઓ ખ્યાતિ અને પૈસા પાછળ પડતા નથી.
- ◆ સમ્યગ્દર્શન (આત્મ સાક્ષાત્કાર) મેળવવા માટે હું સત્યનો સ્વિકાર કરવા (Ready to accept) અને તે સત્ય અનુસાર પોતાને બદલવા (Ready to change) માટે તૈયાર છું.
- ◆ મારે મારી જાતને બદલવાની છે (જે સરળ છે) બીજાને નહીં કે જે અતિ કઠિન છે અને આક્રોશ, નિરાશા અને ઉદ્ઘેગાનું કારણ બને છે.
- ◆ હું હંમેશા યાદ રાખીશ કે દરેક જીવ પાસે અનંતકાળ રહેવાના બે જ વિકલ્પો છે. (1) સિદ્ધાવસ્થા (અનંત સુખ) અને (2) નિગોદ (અનંત દુખ). મારે સિદ્ધાવસ્થા માટે જ પુરુષાર્થ કરવાનો છે અન્યથા નિગોદ કોઈપણ પ્રયત્ન વગર (By default) મળવાનું જ છે.
- ◆ મારી તુલના મારે બીજા સાથે નથી કરવાની. પરંતુ મારી આજને મારે મારી ગઈકાળ સાથે સરખાવીને આજને સુધારવાની છે. આજ દૈનિક પ્રગતિનો (Daily progress) માર્ગ છે.
- ◆ આ નિયમોને આખા દિવસ દરમિયાન પ્રયોગમાં લાવીશ અને સૂતા પહેલાં તેમાં જે ક્ષતિ થઈ હોય તેને તપાસીને ભવિષ્યમાં સુધારવાનો પ્રયત્ન કરીશ.



**ગ્રન્થ - ધર્મ એટલે શું?**

**ઉત્તર - ધર્મનો સામાન્ય અર્થ સંપ્રદાય અનુસાર કરવામાં/સમજવામાં આવે છે. પરંતુ ધર્મનો સાચો અર્થ ‘વસ્તુનો સ્વભાવ (ગુણધર્મો) તે ધર્મ’ છે.**

**ગ્રન્થ - આત્માનો સ્વભાવ (ગુણધર્મ) શું છે?**

**ઉત્તર - આત્માનો સ્વભાવ (ગુણધર્મ અર્થાત્ લક્ષણ) જાણવા-જોવાનો (દેખવાનો) છે.**

**ગ્રન્થ - આત્માની ઓળખ શું? તેનો અનુભવ કઈ રીતે થાય?**

**ઉત્તર - સર્વેજનોને પોતાના ભાવો, જ્ઞાન, જગત, વગેરે જણાય છે. છતાં પોતાને આત્મા નહીં માનતાં શરીર સમજે છે કે જે મિથ્યાત્વ છે. જો પોતાને શરીર માનવામાં આવે તો આંખ સારી હોવા છતાં મૃત્યુ બાદ તે આંખોથી દેખી શકતું નથી પરંતુ તે જ આંખોને જો કોઈ પ્રજ્ઞાયક્ષુના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવે તો, તે દેખી શકે છે. તેથી નક્કી થાય છે કે જાણવા-જોવાવાળો આત્મા મૃત શરીરમાંથી ચાલ્યો ગયો છે, જ્યારે તેવો જ જાણવા-જોવાવાળો આત્મા તે પ્રજ્ઞાયક્ષુના શરીરમાં હાજર/બીરાજમાન છે કે જેને કારણે તે દેખી શકે છે. આ જ રીતે જાણવા-જોવાવાળા આત્માની ઓળખ કરી, આંખોથી કોયોને નિહાળે છે તે જ્ઞાયક-જાણવાવાળો તે હું પોતે જ, નહિ કે આંખો અને તે જ હું છું, ‘સોઈ’, ‘તે જ્ઞાનમાત્ર સ્વરૂપ જ હું છું’ એમ નક્કી કરવું અર્થાત્ હું માત્ર જોવા-જાણવાવાળો જ્ઞાયક-જ્ઞાનમાત્ર-શુદ્ધાત્મા છું એવી ભાવના ભાવવી અને તેમજ અનુભવવું. તે જ અનુભવની/સમ્યગદર્શનની રીત છે.**

**ગ્રન્થ - સમ્યગદર્શન માટે શું યોગ્યતા જરૂરી છે?**

**ઉત્તર - સામાન્ય રીતે સજજનતા, સરળતા, અન્યાય-અનિતિનો ત્યાગ, અભક્ષ્ય (માંસ, મરછી, માખણ, મધ, કંદમૂળ, રાત્રિભોજન, અથારું, પાપડ, વગેરે)નો ત્યાગ, સપ્ત મહિન્યસન (જુગાર, દારુ, માંસ, વેશ્યાગમન, ચોરી, શિકાર અને પરસ્વીગમન અથવા પરપુરુષગમન)નો ત્યાગ, ભવભ્રમણનો ઉર, સંસાર અસાર લાગવો, ભવ રોગ સમાન લાગવો, સ્વ-આત્માના કલ્યાણની તીવ્ર ઈરછા, બાર ભાવનાનું ચિંતન, સર્વે જીવોને મૈત્રી વગેરે ચાર ભાવનાથી જ જોવા-સમજવા, તત્ત્વનો નિર્ણય કરવો અને સાચા દેવ-ગુરુ-ધર્મ/શાસ્ત્રનો પરમ આદર આવશ્યક છે.**

**મैત्रી ભાવના** - સર્વ જીવો પ્રત્યે મैત્રી ચિંતવવી, મારો કોઈ જ દુશ્મન નથી એમ ચિંતવવું, સર્વ જીવોનું હિત ઈચ્છવું.



**પ્રમોદ ભાવના** - ઉપકારી તથા ગુણી જીવો પ્રત્યે, ગુણા પ્રત્યે, વીતરાગ ધર્મ પ્રત્યે પ્રમોદભાવ લાવવો.



**કરુણા ભાવના** - અધર્મી જીવો પ્રત્યે, વિપરીતધર્મી જીવો પ્રત્યે, અનાર્ય જીવો પ્રત્યે કરુણાભાવ રાખવો.



**મદ્યસ્થ ભાવના** - વિરોધીઓ પ્રત્યે મદ્યસ્થભાવ રાખવો.



- મુખપૃષ્ઠની સમજણ -  
આપના જીવનમાં સમ્યાદર્શનનો ભૂર્યોદય થાય અને તેના કુળરૂપ-અવ્યાબાધ સુખરસ્વરૂપ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય એજ ભાવના.